

INEOS Styrolution India Ltd.

5th Floor, Ohm House-II, Ohm Business Park, Subhanpura, Vadodara-390023, Gujarat, India

www.inesostyrolutionindia.com

October 21, 2022

To,

BSE Limited

Dept. DSC_CRD Phiroze Jeejeebhoy Towers, Dalal Street Mumbai 400 001

BSE Scrip Code: 506222

National Stock Exchange of India Limited

Exchange Plaza, Plot No. C/1, 'G' Block, Bandra- Kurla Complex, Bandra ('E') Mumbai 400 051

NSE Symbol: INEOSSTYRO

Sub.: Newspaper Advertisement – Disclosure under Regulation 30 and Regulation 47 of SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015 ("SEBI Listing Regulations")

Dear Sir/Madam,

Pursuant to the provisions of Regulation 30, read with Schedule III Part A and Regulation 47, of the SEBI Listing Regulations, we hereby enclose copies of newspaper publication of the Recommendations of the Committee of Independent Directors' on 'Open Offer' w.r.t Regulation 26(7) of the SEBI (Substantial Acquisition Of Shares And Takeovers) Regulations, 2011, in the following newspapers:

- 1. The Financial Express English National Daily English all India Edition
- 2. The Jansatta Hindi National Daily Hindi all India Edition
- 3. Navshakti Marathi Daily Mumbai Marathi Mumbai Edition
- 4. Vadodara Samachar Gujarati Daily Gujarati Vadodara Edition

The above information is also available on the website of the Company i.e. <u>Styrolution India</u> (<u>ineosstyrolutionindia.com</u>).

Kindly take the above information on your records.

Thanking you,

Yours faithfully, For INEOS Styrolution India Limited

Abhijaat Sinha Head Legal and Company Secretary

Encl: As above

Head Office:
INEOS Styrolution India Ltd.
CIN: L25200GJ1973PLC002436
5th Floor, Ohm House-II, Ohm Business Park,
Subhanpura, Vadodara – 390 023, Gujarat, India

Subhanpura, Vadodara – 390 023, Gujar Tele: +91 265-2303201/02 E-mail: INSTY.secshare@ineos.com Registered Office: INEOS Styrolution India Ltd. CIN: L25200GJ1973PLC002436

5th Floor, Ohm House-II, Ohm Business Park, Subhanpura, Vadodara – 390 023, Gujarat, India

Tele: +91 265-2303201/02 E-mail: INSTY.secshare@ineos.com Date: 21.10.2022

Notice for Loss of Share Certificate of TVS Motor Company Limited (FOR CLAIM FROM IEPF AUTHORITY) Notice is hereby given that the following share certificates of TVS Motor Company Limited have been lost or misplaced or stolen and the legal heir of the registered holder is in the process of applying to Investor Education and Protection Fund (IEPF) Authority for refund of the shares and dividend

Distinctive Nos. Folio No. Name of Share Holder No. of Shares Share Certificate No(s). From To 3959521 3960020 DATTU VAKTE 242226139 24222663 This notice is being issued as per Schedule III of the Investor Education and Protection Fund Authori Accounting, Audit, Transfer and Refund) Rules, 2017, as amended from time to tim

The public are hereby warned against purchasing or dealing in any way, with the above share certificate Any person(s) who has/have any claim in respect of the said share certificate(s) should lodge such clair with evidence to the Company, as its Registered Office, M/s TVS Motor Company Limited, "Chaitanya No. 12, Khader Nawaz Khan Road, Nungambakkam, Chennai – 600 006 (email id: contactus@tvsmotor.con or to its Share Transfer Agents, Integrated Registry Management Services Private Limited, "Kence Towers", 2nd Floor, No. 1 Ramakrishna Street, North Usman Road, T Nagar, Chennai – 600 01 (email id: srirams@integratedindia.in) within 15 days of publication of this notice, after which no clai will be entertained and the legal heir(s) of the registered holder will apply to IEPF for refund of share and dividends. Any person dealing with the above said shares will be doing so at their own risk Name: Darshana Dattaram Vakate Address: B/516 Borbhat Pada SRA C.H.S. LTD, TPS-III Road,

Opp. Gujarati Seva Mandal, Borivali West, VTC: Borivali West S.C District: Mumbai, State: Maharashtra, 400092 (Name and Address of the Legal Heir)



(A Govt. of India Enterprise)

'Khanij Bhavan', 10-3-311/A, Castle Hills, Masab Tank, Hyderabad-500028 CIN:L13100TG1958GOI001674 CONTRACTS DEPARTMENT

Tender Enquiry No.: HO(Contracts)/Distribution/Kirandul/ 2022/152 dated 21.10.2022

MSTC Ref. No.:NMDC/HO/65/22-23/ET/533

NMDC Limited, A "NAVARATNA" Public Sector Company under Ministry of Steel, Govt. of India, invites **online bids** from prospective bidders for the work of "Distribution of 2 Nos 33 kV Power Lines to Substation A & 11B Substation from 132 kV MRSS at SP-III through underground cables to the nearest point at 315 N2 MCC Room, Kirandul, Dist.: Dantewada, State: Chhattisgarh".

from 21.10.2022 to 19.11.2022 from following website links; I. NMDC website-https://tenders.nmdc.co.in/nmdctender/ Central Public Procurement portal-https://www.eprocure.gov.in/ epublish/app and search tender through tender enquiry number MSTC portal-https://www.mstcecommerce.com/eprochome/

The detailed NIT and Bid documents can be viewed and /or downloaded

nmdc/buyer_login.jsp For further help refer to 'vendor guide' given in MSTC website. The bidders are requested to submit their bids online through MSTC Limited website. The details of submission of bid through online are given in NIT. The Bidders on regular basis are required to visit the NMDC's website/CPP Portal/ MSTC website for

For further clarification, the following can be contacted Chief General Manager (Contracts), NMDC Limited, Hyderabad, Fax no. +91-23534746, Tel No. +91-040-2353 2800, email: contracts@nmdc.co.in Chief General Manager (Contracts)

हर एक काम देश के नाम इस्पाती इरादा

corrigendum, if any, at a future date.

RateGain®

RATEGAIN TRAVEL TECHNOLOGIES LIMITED

(Formerly known as RateGain Travel Technologies Private Limited)

CIN: L72900DL2012PLC244966

Registered Office: M-140, Greater Kailash Part-II, New Delhi 110048

Corp. Office: Club 125, Plot No. 3, 4, 5, Tower A, 4th Floor, Sector-125, Noida- 201301, U.P.

Telephone: +91 120 5057 000; E-mail: companysecretary@rategain.com

Website: www.rategain.com

POSTAL BALLOT NOTICE

Notice is hereby given that pursuant to the provisions of Section 108, 110 and other applicable provisions of the Companies Act, 2013 read with Rule 20 and 22 of the Companies (Management and Administration) Rules, 2014 (cumulatively "Act") Regulation 44 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015 ("Listing Regulations"), Secretarial Standard-2 on General Meetings as issued by the Institute of Company Secretaries of India andin accordance with the guidelines issued by the Ministry of Corporate Affairs ("MCA") for holding general meetings/ conducting postal ballot process through remote e-voting vide General Circular Nos. 14/2020 dated 8 April 2020, 17/2020 dated 13 April 2020, 22/2020 dated 15 June 2020, 33/2020 dated 28 September 2020, 39/2020 dated 31 December 2020, 10/2021 dated 23 June 2021, 20/2021 dated 08 December 2021 and 03/2022 dated 05 May 2022 ("MCA Circulars") and any other applicable laws, rules and regulations, if any, approval of members of RateGain Travel Technologies Limited ('the Company') is sought through Postal Ballot only by way of electronic means ("remote e-voting"), in relation to the following Special Resolution as set

a) Variation in the objects mentioned in the prospectus dated December 10, 2021, for

The detailed explanatory statement under Sections 102, 110 and other applicable provisions, if any, of the Act setting out material facts concerning the resolution, forms part of the

This Notice along with the explanatory statement is available on the Company's website at www.rategain.com, websites of the Stock Exchanges that is, BSE Limited ("BSE") and National Stock Exchange of India Ltd.("NSE") at www.nseindia.com respectively, and on the website of National Securities Depository Limited ("NSDL")

The Company has completed the dispatch of Postal Ballot Notice through e-mails to the

. The Cut-off date for the purpose of ascertaining the eligibility of members to avail remote e-voting facility is Monday, October 17, 2022. The members whose name is recorded in the Register of Members of the Company or in the Beneficial Owners maintained by the Depositories as on the Cut-off date shall only be entitled to avail the remote e-voting facility. A person who is not a member as on the Cut-off date should

In compliance with requirements of the MCA Circulars, physical copy of the Notice alongwith Postal Ballot Forms and pre-paid business reply envelope have not been sent to the members for this postal ballot. Members may also note that in compliance with the above MCA Circulars, the communication of assent/ dissent of the members on the resolution proposed in this notice will only take place through the remote e-voting

Members who have not registered their e-mail address are requested to register the

a) Members holding shares in physical mode and who have not registered/updated their

out in the Postal Ballot Notice dated October 18, 2022("Notice"):

utilization of issue proceeds

All the Members are hereby informed that:

members on Thursday, October 20, 2022.

treat the notice for information purposes only.

www.evoting.nsdl.com.

IDBI Asset Management Limited **NMDC Limited**

Place : Mumbai

Date: October 20, 2022

whatsoever.

CIN: U65100MH2010PLC199319 Registered Office: IDBI Tower, WTC Complex, Cuffe Parade, Colaba, Mumbai - 400005 Corporate Office: 4" Floor, IDBI Tower, WTC Complex, Cuffe Parade, Colaba, Mumbai - 400005 Tel: (022) 66442800 Fax: (022) 66442801 Website: www.idbimutual.co.in E-mail: contactus@idbimutual.co.in

(T) IDBI mutual

"IMPORTANT"

vyniist care is taken prior to acceptance of advertising

copy, it is not possible to verify its contents. The Indian

Express (P) Limited cannot be held responsible for such

contents, nor for any loss or damage incurred as a

result of transactions with companies, associations or

individuals advertising in its newspapers or Publications.

We therefore recommend that readers make

necessary inquiries before sending any monies or

entering into any agreements with advertisers or

otherwise acting on an advertisement in any manner

Notice No. 06/2022-23

HOSTING OF UNAUDITED HALF-YEARLY FINANCIAL RESULTS OF THE SCHEMES OF IDBI MUTUAL FUND FOR THE PERIOD ENDED SEPTEMBER 30, 2022

Investors are requested to note that pursuant to Regulation 59 of SEBI (Mutual Funds) Regulations, 1996, a soft copy of the unaudited half-yearly financial results of the schemes of IDBI Mutual Fund for the half-year period ended September 30, 2022 is hosted on IDBI Mutual Fund website (www.idbimutual.co.in) in a userfriendly and downloadable format.

> For IDBI Asset Management Limited (Investment Manager to IDBI Mutual Fund) Company Secretary and Chief Compliance Officer

Statutory Details: IDBI Mutual Fund has been set up as a trust sponsored by IDBI Bank Limited with IDBI MF Trustee Company Limited as the Trustee ("Trustee" under the Indian Trusts Act, 1882) and with IDBI Asset Management Limited as the Investment Manager. Mutual Fund investments are subject to market risks, read all scheme related documents carefully.

INEOS STYROLUTION

Driving Success. Together.

INEOS STYROLUTION INDIA LIMITED

CIN: L25200GJ1973PLC002436 Regd. Office: 5th Floor, OHM House - II, OHM Business Park, Subhanpura, Vadodara - 390 023.

Tel. No.: +91 265 2303201 / 2303202 E mail: INSTY.secshare@ineos.com Website: www.ineosstyrolutionindia.com

Recommendations of the Committee of Independent Directors (IDC) of INEOS Styrolution India Limited ("Target Company") on the Open Offer (hereinafter defined) made by Shiva Performance Materials Private Limited ("Acquirer") together with Geetganga Investment Private Limited ("PAC 1"), Mr. Rakesh Agrawal ("PAC 2") and Mr. Rahul Agrawal ("PAC 3") (PAC 1, PAC 2 and PAC 3 collectively to be referred as "PACs"), in their capacity as the persons acting in concert with the Acquirer, to the public shareholders of the Target Company, under Regulation 26(7) of the Securities and Exchange Board of India (Substantial Acquisition of Shares and Takeovers) Regulations, 2011 and subsequent amendments thereto ("SEBI (SAST) Regulations").

1.	Date	October 20, 2022
2.	Name of the Target Company (TC)	INEOS Styrolution India Limited
3.	Details of the Offer pertaining to TC	Open offer for acquisition of up to 45,72,263 fully paid-up equity shares of face value of INR 10 each ("Equity Shares") from the Public Shareholders of the Target Company representing 26.00% of the Voting Share Capital of the Target Company on a fully diluted basis as on the 10th working day from the closure of tendering period, at a price of INR 848.72 per Equity Share (the "Offer Price") aggregating to total consideration of up to INR 388,05,71,054 (assuming full acceptance) payable in cash. The public announcement dated August 1, 2022 ("PA"), the detailed public statement published on August 5, 2022 ("DPS"), the draft letter of offer dated August 10, 2022 ("DLOF"), and the letter of offer dated October 17, 2022 ("LOF") have been issued by JM Financial Limited on behalf of the Acquirer and the PACs.
4.	Name(s) of the acquirer and PAC	Acquirer: Shiva Performance Materials Private Limited PACs: Geetganga Investment Private Limited (PAC 1) Mr. Rakesh Agrawal (PAC 2); and Mr. Rahul Agrawal (PAC 3).
5.	Name of the Manager to the offer	JM Financial Limited 7th Floor, Cnergy, Appasaheb Marathe Marg, Prabhadevi, Mumbai - 400 025. Tel:+912266303030 Fax:+912266303330 Contact person: Ms. Prachee Dhuri Email: ineos.openoffer@jmfl.com SEBI registration no.: INM000010361
6.	Members of the Committee of Independent Directors (Please indicate the chairperson of the Committee separately)	Mr. Vinesh Sadekar (Chairperson) Ms. Sandra Martyres (Member)
7.	IDC Member's relationship with the TC (Director, Equity shares owned, any other contract / relationship), if any	The members of the IDC are independent directors on the board of directors of the Target Company. None of the members of the IDC hold any Equity Shares securities of the Target Company. Except as mentioned below, none of the members of the IDC have entered into any contract or have any relationship with the Target Company: a. Mr. Vinesh Sadekar is the chairperson of the Audit Committee, the Nomination and Remuneration Committee and Risk Management Committee of the Target Company, and is a member of the Corporate Social Responsibility Committee of the Target Company; and b. Ms. Sandra Martyres is the chairperson of the Stakeholders Relationship and Grievance Committee and the Corporate Social Responsibility Committee of the Target Company, and is a member of the Audit Committee and the Nomination & Remuneration Committee of the Target Company.

securities of the Target Company during the:

None of the members of IDC:

the Acquirer or the PACs during the:

a. 12 months period preceding the date of the PA; and

a. are directors on the boards of the Acquirer or the PACs;

a. 12 months period preceding the date of the PA; and

The IDC has reviewed the PA, the DPS, and the LOF.

c. have any contracts/ relationship with the Acquirer or the PACs.

None of the members of the IDC have traded in any of the Equity Shares

b. period from the date of the PA and till the date of this recommendation.

b. period from the date of the PA and till the date of this recommendation.

b. hold any equity shares or other securities of the Acquirer or the PACs; and

None of the members of the IDC have traded in any of the equity shares/ securities of

The IDC is of the opinion that the Offer Price of Rs. 848.72 (Indian Rupees Eight

hundred forty-eight and paise seventy two only) per Equity Share offered by the

Acquirer is (a) in accordance with the applicable regulations under the SEBI (SAST)

However, IDC would like to point out that the share price of the company is

dynamic in nature and is subject to daily fluctuations and change. The closing share

price (as at the end of day October 19, 2022) of the Target Company on the NSE was

The shareholders are advised to independently evaluate the open offer and take an

Further, Shailesh Haribhakti& Associates, Chartered Accountants, appointed by the

IDC to provide its independent opinion, has confirmed that the Offer Price of Rs.

848.72 (Indian Rupees Eight hundred forty-eight and paise seventy two only) per

Equity Share is in accordance with the Regulation 8(2) of the SEBI (SAST) Regulations and opined that the Offer Price of 848.72 (Indian Rupees Eight hundred

In view of the above, the IDC has set out its recommendation in paragraph 11 above.

This statement of recommendation will also be available on the website of the Target

https://www.ineosstyrolutionindia.com/INTERSHOP/web/WFS/Styrolution-India

Site/en_US/-/USD/ViewContent-Start?PageletEntryPointID=investors-investors

Shailesh Haribhakti & Associates, Chartered Accountants, appointed by the IDC to

informed decision, whether or not to tender their equity shares in the open offer.

forty eight and paise seventy two only) per Equity Share is fair and reasonable.

The recommendation was unanimously approved by the members of the IDC

provide its independent opinion with respect to the Offer Price

To the best of our knowledge and belief, after making proper enquiry, the information contained in or accompanying this

statement is, in all material respects, true and correct and not misleading, whether by omission of any information or

otherwise, and includes all the information required to be disclosed by the Target Company under the SEBI (SAST)

Regulations, and (b) accordingly, the Open Offer appears to be fair and reasonable.

Technologies Limited by sending duly signed request letter at einward.ris@kfintech.com with details of folio number, Name and address of the Member with a self-attested copy of PAN card, and self-attested of Aadhaar or may also send an e-mail to the Company

e-mail id with the Company are requested to register/update their email id with Kfin Secretary at companysecretary@rategain.com. b) Members holding shares in dematerialized mode are requested to register/update their

email id with the relevant Depository Participant(s) where they maintain their demat Post successful registration of the email, the member would get a soft copy of the notice

and the procedure for e-voting along with the User ID and Password to enable e-voting . Any members who have not received the postal ballot notice may apply to the Company at companysecretary@rategain.com.

The remote e-voting period commences on Friday, October 21, 2022 at 9:00 a.m. and ends on Saturday, November 19, 2022 at 5:00 p.m. for all the shareholders, whether holding shares in physical form or in demat form. The remote e-voting module shall be disabled by NSDL for voting thereafter. Once the vote on a resolution is cast by a member, no change will be allowed subsequently. The Company has appointed Mr. Shreyansh Pratap Jain, Company Secretary in whole

time practice having (Membership No.: F 8621), as scrutinizer for conducting the entire postal ballot process by way of remote e-voting in a fair and transparent manner.

The results of the Postal Ballot/ e-voting will be declared on or before Monday November 21, 2022 at 5:00 p.m. at the registered office of the Company by the Chairman or any other person authorized by him in that behalf. The results along with scrutinizer's report shall be placed on the website of the Company i.e. www.rategain.com and on the website of the NSDL i.e. www.evoting.nsdl.com and shall also be communicated to BSE and NSE, where the Companies shares are listed and be made available on their respective websites viz. www.bseindia.com and www.nseindia.com.

In case of any queries or grievances pertaining to e-voting procedure, Shareholders may refer the Frequently Asked Questions (FAQs) for Shareholders and e-voting user manual, available at the download section of www.evoting.nsdl.com or contact Ms. Sarita Mote. Assistant Manager, NSDL, Trade World, 'A' Wing, 4th Floor, Kamala Mills Compound, Senapati Bapat Marg, Lower Parel (West), Mumbai-400013, at evoting@nsdl.co.in or call on toll free no.: 1800 1020 990 and 1800 22 44 30. By order of the Board of Directors


Noida, October 20, 2022

financialexp.epapr.in

For RateGain Travel Technologies Limited

Thomas P. Joshua Vice President - Legal & Company Secretary Mem. No.: F 9839

* The Indian EXPRESS



Place: Mumbai Date: October 20, 2022

Regulations.

Trading in the Equity

relationship with the

Equity shares owned,

any other contract /

relationship), if any.

Trading in the Equity

shares / other securities

Recommendation on the

Open offer, as to whether

Summary of reasons for

Details of voting pattern

Details of Independent

Any other matter(s) to be

Advisors, if any.

highlighted

recommendation

the offer is fair and

of the acquirer by IDC

Members

reasonable

acquirer (Director.

of the TC by IDC

IDC Member's

Members

10.

shares / other securities

Vinesh Sadekar Chairperson - Committee of Independent Directors

For and on behalf of the Committee of the Independent Directors



INDRAPRASTHA MEDICAL CORPORATION LIMITED

Regd. Office: Sarita Vihar, Delhi-Mathura Road, New Delhi – 110 076 (India)
Corporate Identity Number: L24232DL1988PLC030958
Phone: 91-11-26925858, 26925801, Fax: 91-11-26823629

E-mail: imcl@apollohospitals.com, Website: delhi.apollohospitals.com

Pursuant to Regulation 47 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, notice is hereby given, that a meeting of the Board of Directors of the Company will be held on Friday, 4th November, 2022, inter-alia, to consider and approve, the unaudited financial results for the guarter and half year ended 30th September, 2022.

The above information is also available on the website of the Company i.e. https://delhi.apollohospitals.com and on the website of the stock exchanges i.e. on www.bseindia.com and www.nseindia.com

Priya Ranjan New Delhi AVP - Corporate Affairs & Legal 20.10.2022



Phone: 91-079-23232701/4, Fax: 91-079-23222481, Website: www.gidb.org TENDER NOTICE Gujarat Infrastructure Development Board (GIDB) is pleased to invite

competitive bids for "Selection of Survey Agency for Drone Topography Survey & Bathymetry (Hydrology) Survey for 3 Islands i.e. Ajad, Piram & Kadia Islands of Gujarat". The Request for Qualification (RFQ) cum Request for Proposal (RFP) Document is available on https://gidb.nprocure.com and www.gidb.org . Chief Executive Officer

Gujarat Infrastructure Development Board (GIDB)

(Rs in Lakhs)



Shemaroo Entertainment Limited

(CIN: L67190MH2005PLC158288)

Registered Office: Shemaroo House, Plot No. 18, Marol Co-Op. Industrial Estate, Off Andheri - Kurla Road, Andheri (E), Mumbai - 400 059

Tel: +91 - 22 - 4031 9911 Fax: +91 - 22 - 28519970 E-mail: compliance.officer@shemaroo.com Websites: www.shemaroo.com / www.shemarooent.com

EXTRACT OF THE UNAUDITED CONSOLIDATED FINANCIAL RESULTS FOR THE QUARTER AND HALF YEAR ENDED SEPTEMBER 30, 2022

\neg		Quarter	ended	Half Year ended	
	Particulars	30.09.2022	30.09.2021	30.09.2022	
		(Unaudited)	(Unaudited)	(Unaudited)	
1.	Total Income from operations	14,716	12,320	24,482	
2.	Net Profit for the period (before Tax, Exceptional and/ or Extraordinary items)	482	215	645	
3.	Net Profit for the period before tax (after Exceptional and/ or Extraordinary items)	482	215	645	
4.	Net Profit for the period after tax (after Exceptional and/ or Extraordinary items)	344	280	387	
5.	Total Comprehensive Income (after tax)]	328	267	340	
6.	Equity Share Capital (Face Value Rs 10 each)	2,718	2,718	2,718	
7.	Reserves (excluding Revaluation Reserve) as shown in the Audited Balance Sheet of the previous year	394	2/	55,461	
8.	Earning Per Share of Rs 10 each (before and after extraordinary items) Basic: Diluted:	1.25 1.25	1.00 1.00	1.34 1.34	

- a. The above results have been reviewed by the Audit Committee and approved by the Board of Directors at their meeting held on October 19, 2022.
- half year ended September 30, 2022 filed with the Stock Exchange under Regulation 33 of the SEBI (Listing and Other Disclosure Requirements) Regulations, 2015. The full format of the Unaudited Financial Results are available on the websites of the Company, National Stock Exchange of India Limited and BSE Limited at www.shemarooent.com, www.nseindia.com and www.bseindia.com, respectively.
- Additional Information on Standalone Financial Results is as below:

	Quarter	Half Year ended		
Particulars	30.09.2022	30.09.2021	30.09.2022	
	(Unaudited)	(Unaudited)	(Unaudited)	
ncome from operations	14,061	12,044	23,282	
Profit before tax	374	282	524	
Profit after tax	237	347	266	
otal Comprehensive Income (after tax)	237	347	266	

For Shemaroo Entertainment Limited

Place: Mumbai Date: October 20, 2022

Hiren U Gada (DIN:01108194)

Edelweiss Alternative Asset Advisors Limited

Corporate Identity Number- U67190MH2008PLC182205

	Financial Results for the quart	er chaca 30 3cp	terriser 2022	(₹ in cror
	Particulars	Quarter September 30, 2022 (Unaudited)	Ended September 30, 2021 (Unaudited)	Year Ended March 31, 2022 (Audited)
1	Total income from operations	73.48	49.19	215.98
2	Net Profit / (Loss) for the period (before Tax, Exceptional and/or Extraordinary items)	26.50	10.78	50.58
3	Net Profit / (Loss) for the period before Tax (after Exceptional and/or Extraordinary items)	26.50	10.78	50.58
4	Net Profit / (Loss) for the period after tax (after Exceptional and/or Extraordinary items)	20.18	10.89	48.93
5	Total Comprehensive Income for the period	20.12	11.07	48.54
6	Paid up Equity Share Capital (Face Value of ₹ 10/- Per Share)	12.37	12.37	12.37
7	Instruments entirely equity in nature	110.00	110.00	110.00
8	Reserves (excluding Revaluation Reserves)	72.62	0.06	32.13
9	Securities Premium Account	11.91	11.91	11.91
10	Net worth ¹	195.00	122.44	154.51
11	Paid up Debt Capital / Outstanding Debt	136.43	-	84.86
12	Outstanding Redeemable Preference Shares	-	-	-
13	Debt Equity Ratio	0.70	-	0.55
14	Earnings Per Share (Face Value of ₹ 10 each)			
	- Basic (Not annualised)	10.71	5.78	25.96
	- Diluted (Not annualised)	10.71	5.78	25.96
15	Capital Redemption Reserve	-	-	-
16	Debenture Redemption Reserve	-	-	-
17	Debt Service Coverage Ratio (DSCR) ² (Not annualised)	8.23	-	1.25
18	Interest Service Coverage Ratio (ISCR) ³ (Not annualised)	8.23	-	26.47

'DSCR = Profit before interest and tax / (Interest expense + Principal repayment in next six months) ³ISCR = Profit before interest and tax / Interest expense

- 1 The above is an extract of the detailed format of quarterly financial results filed with the Stock Exchanges in accordance with Regulation 52 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015 as amended (the 'Listing Regulations, 2015') and the Accounting Standards specified under section 133 of the Companies Act, 2013 read with the Companies (Indian Accounting Standards) Rules, 2015 as amended and the relevant provision of the Companies Act, 2013, as applicable. The full format of the quarterly financial results are available on the website of the Stock exchange (www.bseindia.com) and the Company's website www.edelweissalternatives.com.
- For the other line items referred in Regulation 52 (4) of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, as amended, the pertinent disclosures have been made to the BSE Limited and can be accessed on the Company's website - www.edelweissalternatives.com. The above financial results of Edelweiss Alternative Asset Advisors Limited ('the Company') for the quarter and
- half year ended September 30, 2022 have been reviewed and recommended by the Audit Committee and approved by the Board of Directors at its meeting held on October 20, 2022. The above financial results for the quarter and half year ended September 30, 2022 of the Company have been
- subjected to Limited Review by the Statutory Auditors of the Company and the Auditors have issued an unmodified review report. Figures for the previous quarter/year have been regrouped/reclassified whereever necessary to conform to

on behalf of the Board of Directors **Edelweiss Alternative Asset Advisors Limited**

Sushanth Nayak Wholetime Director

Mumbai, October 20, 2022.

DIN.: 02857645

DIN: 00046815

of INEOS Styrolution India Limited

current quarter/year presentation.

निर्मला देवी मार्ग, सेक्टर 10, सीबीडी बेलापुर, नवी मुंबई, महाराष्ट्र - 400614 तीन साल की अवधि के लिए एसबीआई के विदेशी कार्यालयों (एफओ) के एप्लिकेशनों

की अधोसंरचनाओं और सेवाओं के लिए सहायता की प्रोक्योरमेंट भारतीय स्टेट बैंक ने तीन साल की अवधि के लिए एसबीआई के विदेशी कार्यालयों (एफओ) के एप्लिकेशनों की अधोसंरचनाओं और सेवाओं के लिए सहायता की प्रोक्योरमेंट के लिए आरएफपी को एक शद्धिपत्र 2 दिनांक 20.10.2022 जारी किया है, आरएफपी संदर्भ संख्या: SBI/GITC/ITFO/2022/2023/887 दिनांकित 19.09.2022 देखें. विस्तृत आरएफपी के शुद्धिपत्र 2 के लिए कृपया https://www.sbi.co.in पर 'प्रोक्योरमेंट न्यूज' और ई-प्रोक्योरमेंट अभिकरण पोर्टल https://etender.sbi/SBI/ देखें. स्थान: नवी मुंबई उप- महाप्रबंधक

तिथि: 20.10.2022 (आईटी-आरआरबी और एफओ टेक ऑप्स)

सर्कल शास्त्र सेन्टरः पूर्वी दिल्ली, मयूर विहार फेज-2, पॉकेट-ई दिल्ली-110091

ई—नीलामी सचना अर्थात अचल संपत्तियों की बिक्री के लिए 23.09.2022 को अंग्रेजी समाचार पत्र-'फाइनेंशियल एक्सप्रेस' (पेज नंबर 19) और हिंदी समाचार पत्र— 'जनसत्ता' (पेज नं. 15) क्रमांक ७ पर [श्री अजय सिंह एवं श्रीमती रीता सिंह के ऋण खाते में। की सम्पत्ति अभी बिक्री के लिए उपलब्ध नहीं है। इस सम्पत्ति को बैंक ने 21.10.2022 को होने वाली ई—नीलामी प्रक्रिया से वापस ले लिया है। शेष ई-नीलामी सूचना यथावत रहेगी।

दिनांकः 20.10.2022 पंजाब नेशनल बैंक

दक्षिण रेलवे

विद्युत (सामान्य) निर्माण. चेन्नई एग्मोरे निविदा सूचना सं. ई-सीएन-एमडीयू-ईओटी 4-2022-23 आरटी तिथि : 17-10-2022

भारत के राष्ट्रपति की ओर से उप मुख्य विद्युत अभियंता/जन/कंस./एस.रेलवे/एग्मोरे, चेन्नई 600008 द्वारा निम्न कार्य के लिये ई-निविदा आमंत्रित है:

कार्य का नाम : एचओजी-तृतीकोरिन (टी-एन) कोचिंग डिपो में रेल गाडियों के कन्वर्जन के सिलसिले में एलएचवी कोचेज के रखरखाव के लिये मानक पिट लाइन्स के लिये तीन फेज 750वी एसी आपूर्ति व्यवस्था का प्रावधान। निविदा सचना सं. एवं तिथि : नं. ई-सीएन-एमडीयू-ई ओटी 4-2022-23 तिथि 17.10.2022

पूर्णता अवधि : 6 माह अन. कार्य लागत : रु. 2.01.52.755.38/-निविदा प्रपत्र का मुल्य : निल

धरोहर राशि भुगतान : रु. 2,50,800/-निविदा बंद होने की तिथि: 10.11.2022 सम्पूर्ण विवरण www.ireps.gov.in में देखी जा सकती है।

> उप मुख्य विद्युत अभियंता/सामान्य/कन्स./दक्षिण रेलवे चेन्नई एग्मोरे

Follow us on: twitter.com/GMSRailway

COURT NOTICE

The Court Of Harpreet Kaur Randhawa District And Sessions Judge, Amritsar Mohamad Imran

Vijay Kumar Goyal CNR: PBAS01-023408-2019 Next Date: 01-11-2022 Publication Issued To: 1) Vijay

Kumar Goyal S/o Sadhu Ram R/o Ward No 9, Tibbi PS, Tibbi distt. hanumangarh, rajasthan (driver of truck no. RJ31GA8609) 2) Simran Rani S/o Manoj Kumar R/o Ward No. 15, Punjabi Mohalla. Hanumangarh, Rajasthan (Owner Of Truck No. RJ31GA8609) In above titled case, the defendant(s) respondent(s) could not be served. It is ordered that defendant(s) /respondent (s) should appear in person or through counsel on 01-11-2022 at 10:00 a.m. for details logon to: https://highcourtchd.gov.in/?trs=district notice&district=Amritsar District And Sessions Judge Amritsar

COURT NOTICE

In The Court Of Ms. Mamta Mehmi Civil Judge (Junior Division), Ludhiana Punjab State Power

Corporation Ltd Vs Ram Milan

CNR NO: PBLD02-004698-2021 Next Date: 17-11-2022 Publication Issued To: Ram Milan :- Son Of Ram Pher R/o Village Bhukhdi Khurd, Distt, Ludhiana

In above titled case, the defendant(s)/ respondent(s) could not be served. It is ordered that defendant(s)/respondent(s) should appear in person or through counsel on 17-11-2022 at 10:00 a.m. for details logon to:

https://highcourtchd.gov.in//trs=district_no tice&district=Ludhiana Civil Judge (Junior Division) Ludhiana

मैगनोलिया ग्लास एलएलपी (नं. एएए-0633) पंजीकृत कार्यालयः 712, एम्मार कैपिटल टॉवर I, सिकंदरपुर, गुरुग्राम (हरियाणा) 122001

एतद्दवारा सूचना दी जाती है कि कंपनी अधिनियम, 2013 की धारा 366 की उप–धारा (2)के अनुसरण में, मैगनोलिया ग्लास एलएलपी (सं. एएए–0633) द्वारा इस एलएलपी को एक प्राइवेट लिमिटेड कंपनी मैगनोलिया ग्लास प्राइवेट लिमिटेड में स्थिति परिवर्तित करने के लिए एक आवेदन नई दिल्ली स्थित रजिस्टार को दिया गया है।

2. कंपनी के प्रमुख उद्देश्य में अन्य बातों के साथ—साथ इस प्रकार का कार्य शामिल हैं: बोतल, कांच के बने पदार्थ आदि सहित सभी प्रकार के कांच के विनिर्माताओं के रूप में और डीलिंग में व्यवसाय करना शामिल है, जो व्यापक रूप से प्रस्तावित कंपनी के मेमोरेंडम ऑफ एसोसिएशन के मख्य उद्देश्य खंड में

शामिल हैं। 3. प्रस्तावित कंपनी के मसौदा ज्ञापन और आर्टिकल्स ऑफ एसोसिएशन की एक प्रति का निरीक्षण कंपनी के पंजीकत कार्यालय में

किया जा सकता है। 4. एतद्दवारा नोटिस दी जाती है कि इस आवेदन पर आपत्ति करने वाला कोई भी व्यक्ति, अपनी आपत्ति लिखित रूप में केंद्रीय पंजीकरण केंद्र (सीआरसी), आईआईसीए, प्लॉट नंबर 6 से 8, सेक्टर 5, आईएमटी मानेसर, जिला–गुरुग्राम (हरियाणा)–122050 स्थित रजिस्ट्रार को और एलएलपी को उसके पंजीकृत कार्यालय में ऊपर दिए गए पते पर एक प्रति के साथ इस नोटिस के प्रकाशन की तारीख से इक्कीस दिनों के भीतर दर्ज करा

सकता है। कते मैगनोलिया ग्लास एलएलपी नवनीत गुप्ता, एमजी साझीदार



एयू स्मॉल फाईनेन्स बैंक लिमिटेड (ए शेड्यूल्ड कमशियल वैंक) रजिस्टर्ड ऑफिस: 19-A, ध्लेश्वर गार्डन, अजमेर रोड़, जयपुर-302001 (CIN:L36911RJ1996PLC011381)

सिक्युरिटाईजेशन अधिनियम 2002 की धारा 13 (2) के अन्तर्गत मांग सुचना पत्र अधोहस्ताक्षरकर्ता एयू स्मॉल फाईनेंस बँक लिमिटेड के प्राधिकृत अधिकारी है।''वित्तीय आस्तियों का प्रतिभृतिकरण और पुनर्गठन तथा प्रतिभृति हित का प्रवर्तन अधिनियम 2002 की "धारा 13(2) के अन्तर्गत प्राधिकृत अधिकारी ने ऋण खातों के गैर निष्पादनीय आरितयों (एन.पी.ए.) होने पर नीचे दी गई तालिका के अनुसार ऋणीयों /सह-ऋणीयों / गारण्टर बंधककर्ताओं (जिन्हें आगे ऋणी /ऋणीयों के नाम से सम्बोधित किया जायेगा) को 60 दिनों के नोटिस प्रेषित किये े, नोटिस के अनुसार यदि ऋणी 60 दिनों के भीतर सम्पूर्ण ऋण राशि जमा नहीं करवाते हैं तो प्राधिकृत अधिकारी प्रदत्त शक्तियों के प्रयोग में अधिनियम की धारा 13 उपधारा 4 व 14 के अन्तर्गत कदम उठाने हेतु खतंत्र होगा। जिसमें अन्य बातों के साथ-साथ उसे प्रतिभूत आस्तियों का कब्जा लेने की शक्ति तथा उनका विक्रय करना सम्मिलित है। अतः आप ऋणीयों को यह सूचित किया जाता है कि निन्न सूची में दी गई सम्पूर्ण बकाया ऋण राशि भविष्य के व्याज तथा खर्चों एवं लागतों इत्यादि के साथ 60 दिवस के भीतर जमा करवा दें। इसके अतिरिक्त आप ऋणीयों को यह सुचित किया जाता है कि उपरोक्त 13(13) में निर्दिष्ट सूचना की प्राप्ति के पश्चात प्रतिभूत लेनदार की पूर्व लिखित सहमति के बिना सूचना में निर्दिष्ट अपनी किन्ही प्रतिभूत आस्तियों को विक्रय द्वारा या पट्टे द्वारा अथवा किसी माध्यम से अन्तरित नहीं करेंगे। ऋणीयों का ध्यान इस ओर आकर्षित किया जाता है कि उक्त अधिनियम की धारा 13(8) सपठित नियम 3 (5) प्रतिभूति हित (प्रवर्तन) नियम 2002 के अनुसार ऋणी अपनी बंधक सम्पत्ति को उसके द्वारा उपगत सभी खर्चों प्रभारों और व्ययों के सहित प्रतिभूत लेनदार द्वारा विक्रय या अन्तरण के लिये नीलामी सुचना के प्रकाशन से पूर्व किसी भी समय भुगतान करके मुक्त करवा सकते हैं।

ऋण खाता संख्या / ऋणी/ सहऋणी/बन्धकर्ता/ गारन्टर का नाम	धारा 13(2) के अन्तर्गत नोटिस की दिनांक व राशि	बंधक सम्पत्ति का विवरण
(खाता सं.) 2121248535077781 मैसर्स रिद्धी ट्रेडिंग कम्पनी जरिये प्रोपराइटर श्री गोनू राम (ऋणी), श्री गोनू राम पुत्र श्री श्याम फूल (जमानतदार/बंधककर्ता), श्रीमती गीता देवी पत्नि श्री गोनू राम (जमानतदार)	15 अक्टूबर 2022 ₹ 1,64,10,071.45/- रु. एक करोड चौसठ लाख दस हजार इकेतर व पैतालिस पैसे मात्र दिनांक 15 अक्टूबर 2022 तक	वृष्टिबंधक की अनुसूची :- वर्तमान और भविष्य दोनों में वर्तमान संपत्ति और वल अवल संपत्तियों पर वृष्टिबंधक के माध्यम से विशेष प्रभार। बंधक अवल सम्पत्तियों की अनुसूची :- सम्पत्ति के सभी अभिन्न अंग सम्पत्ति रिश्चत आवासीय सम्पत्ति क्षेत्रफल 200.00 वर्ग गज खाता नं. 00045, खसरा नं. 166, रिश्चत एरिया ग्राम ममुरा, तहसील दादरी व जिला गौतम बुद्ध नगर, उत्तर प्रदेश जो कि श्री गोनु राम के स्वामित्व में है।

स्थान : दिल्ली (एनसीआर) दिनांक: 20-10-2022 प्राधिकृत अधिकारी एयु स्मॉल फाइनेंस बेंक लिमिटेड

Cent GST Loan chiggs d'es selles glièse Central Bank of India **Empower your business GST Complia** Low interest rate 30 सितंबर, 2022 को समाप्त तिमाही के लिए अलेखापरीक्षित स्टैंडअलोन और समेकित वित्तीय परिणाम

-	П			स्टेंडअलोन			समेकित		
			समाप्त तिमाही समाप्त वर्ष समाप्त विमा			समाप्त वर्ष			
	苏. 说.	विवरण	समाप्त तिमाड़ी	पिछले वर्ष की संबंधित समाप्त रिमारी	समाप्त पिछला वर्ष	समाप्त तिमाही	पिछले वर्ष की संबंधित समाप्त तिमाही	समाप्त पिछता वर्ष	
ı			30.09.2022 अलेखापरीक्षित	30.09.2021 अलेखापरीक्षित	31.03.2022 लेखापरीक्षेत	30.09.2022 अलेखापरीक्षित	30.09.2021	31.03.2022 संखापरीक्षेत	
н	1	परिचातन से कुल आय	7,06,496	6,52,712	25,77,013	7,09,308	अलेखापरीक्षेत 6,55,168	25,87,083	
H	_	इस अवधि हेतु शुद्ध लाभ/(हानि), (कर पूर्वअपवाद स्वरूप एवं अथवा असाधारण मर्दे#)	62,312	37,275	2,26,148	64,903	32,584	2,30,062	
r	_	इस अवधि हेतु कर पूर्व शुद्ध लाभ/(हानि), (अपवाद स्वरूप एवं अथवा असाधारण मदों के पश्चात#)	62,312	35,275	1,71,696	64,903	30,584	1,75,610	
r		इस अवधि हेतु कर पश्चात शुद्ध लाभ/(हानि), (अपवाद स्वरूप एवं अथवा असाधारण मदों के पश्चात#)	31,817	25,002	1,04,483	34,141	20,078	1,07,579	
r		इस अवधि हेतु कुलसमग्र आय (अवधि हेतु लाभ/ (हानि)सहित (कर पश्चात)	Refer Note 3	Refer Note 3	Refer Note 3	Refer Note 3	Refer Note 3	Refer Note 3	
ı		एवं अन्य समग्र आप (कर पश्चात)}							
Г	6	प्रदत्त इक्विटी शेयर पूंजी (प्रति शेयर १ 10/- का अंकित मूल्य)	8,68,094	8,68,094	8,68,094	8,68,094	8,68,094	8,68,094	
Г	7	रिजर्व (पुनर्मृत्यांकन रिजर्व को छोड़कर)	+	+	15,13,082	-	-	15,15,352	
Г	8	प्रतिभृति प्रीमियम खाता	7,46,663	7,46,663	7,46,663	7,46,663	7,46,663	7,46,663	
	7.1	नेट वर्ष	24,38,768	23,18,566	23,80,185	24,45,926	23,16,394	23,81,566	
		चुकता ऋण पूंजी/बकाया ऋण	32.61%	60.67%	42.00%	31.93%	58.59%	40.96%	
L	-	बकाया रिडीमेविल वरीयता शेयर		**		*		*	
	0.00	ऋण इक्विटी अनुपात	0.25	0.26	0.25	0.25	0.26	0.26	
П	13	प्रति शेयर आय (रु.10/- प्रति) (नियमित और अनियमित परिचालन हेतु) – 🔃 1. बेसिक:	0.37	0.29	1.27	0.39	0.23	1.31	
L	217	2. डाइसुरेड:	0.37	0.29	1.27	0.39	0.23	1.31	
L	700	कैपिटल रिडेम्पशन रिजर्व		7/1		-			
	- C	डिबेचर रिडेम्पशन रिजर्व		annone Parameter	american de la compansión	and a second			
-		डेब्ट सर्विस कवरेज अनुपात					NOT APPLICABLE		
L	17	इट्रेस्टसर्विस कवरेज अनुपात	NOT APPLICABLE	NOT APPLICABLE	NOT APPLICABLE	NOT APPLICABLE	NOT APPLICABLE	NOT APPLICABLE	
	-		F2 2	Y (M) -	- Dunklandin Der	D-0		- A	

नोट 1: उपरोक्त सेबी (लिस्टिंग और अन्य प्रकटीकरण आवश्यकताएँ) विनियम, 2015 के विनियम 33 और 52 के तहत स्टॉक एक्सचेंज (ऑ) के साथ दावर तिमाही/अर्थवार्षिक वित्तीय परिणामों के विस्तृत प्रारूप का एक उद्धरण है। का पूर्ण प्रारूप तिमाही/अर्थवार्षिक वित्तीय परिणाम स्टॉक एक्सचेंज (ओं) और सुचीबद्ध इकार्ड की वेबसाइटों पर उपलब्ध हैं। [www.bseindia.com, www.nseindia.com और www.centralbankofindia.co.in]

नोट 2: लिस्टिंग विनियमों के विनियम 52(4) में संदर्शित बैंक के लिए लागू अन्य लाइन आइटम के लिए, स्टॉक एक्सचेंजों (बीएसई लिमिटेड और नेशनल स्टॉक एक्सचेंज ऑफ इंडिया लिमिटेड) के लिए प्रासंगिक खुलासे किए गए हैं और युआरएल पर पहुँचा जा सकता है [www.bseindia.com, www.nseindia.com]

नोट 3: कल व्यापक आय और अन्य व्यापक आय से संबंधित जानकारी प्रस्तत नहीं की गई है क्योंकि इंडएएस अभी तक बैंक पर लाग नहीं हुआ है।

नोट 4: पिछली अवधि के आंकडों को वर्तमान अवधि के वर्गीकरण के अनुरूप आवश्यक समझे जाने पर पुनर्वर्गीकृत/पुनर्वर्गीकृत किया गया है।

आलोक श्रीवास्तव एम.वी. राव राजीव पुरी दिनांक: 20.10.2022 कार्यकारी निदेशक कार्यकारी निर्देशक कार्यकारी निदेशक प्रबंध निदेशक एवं सीईओ #AyurvedaEverydayAyurvedaEverywhere | ww.centralbnkofindia.co.in | Follow us on: If 🔘 💹 in 🖿 🕪 CentralBankofIndia



RERA REGISTRATION NO.: RC/REP/HARERA/GGM/374/106/2019/68 Dated 12.09.2022 (www.haryanarera.gov.in)

शहर एवं ग्राम्य नियोजन विमाग, हरियाणा सरकार की 19.08.2013 दिनांक अधिसूचना सं. PF-27/48921 और उसमें संशोधन के अनुसार उल्लिखित नीति के नियमों और शर्तों पर विकसित किए जा रहे अफोर्डेबल ग्रुप हाउसिंग प्रोजेक्ट के तहत आवासीय अपार्टमेंट की बुकिंग के लिए सर्वसाधारण से आवेदन आमंत्रित किए जाते हैं। (विवरण विमागीय वेबसाइट tcpharyana.gov.in पर उपलब्ध हैं)

प्रोजेक्ट के विवरण

1. कॉलोनाइजर/डेवलपर	सिग्नेचरग्लोबल (इंडिया) लिमिटेड
 प्रोजेक्ट को प्राप्त स्वीकृति 	अतिरिक्त लाइसेंस संख्या 2020 का 40 दिनांकित 11.12.2020 जो पहले से स्वीकृत लाइसेंस संख्या 2019 का 69 दिनांकित 26.06.2019। संशोधित भवन योजना स्वीकृत दिनांकित 27.09.2021 ज्ञापन सं. ZP-1336/AD(RA)/2021/24247. RC/REP/HARERA/GGM/374/106/2019/68 दिनांकित 14.11.2019 में संशोधन के परिणाम स्वरूप संशोधित RC/REP/HARERA/GGM/374/106/2019/68 दिनांकित 12.09.2022 जो कि अतिरिक्त क्षेत्र 0.74375 एकड़ के साथ अनुमोदित है।
3. स्थान	सेक्टर 63A, गुरुग्राम, हरियाणा।
 प्रोजेक्ट के क्षेत्रफल संबंधी प्रावधान 	6.4875 एकड़ के संशोधित क्षेत्र में फैली आवास योजना में मूल चरण में 714 इकाइयों के अतिरिक्त कुल 103 इकाइयों में से उपलब्ध 103 अतिरिक्त अपार्टमेंट की संख्या है। इनमें से पॉलिसी अनुसार 5% फ्लैट मैनेजमेंट कोटे में आरक्षित हैं और 95% अपार्टमेंट सर्वसाधारण के लिए हैं। समुदाय सुविधाएँ : 2000 वर्गफुट का एक समुदाय मवन और 2000 वर्गफुट का एक ऑगनवाड़ी—सह—क्रेश।

कैटेगरी (टाइप)	यूनिट की संख्या	कारपेट एरिया वर्गमीटर (लगभग)	कारपेट एरिया वर्गफुट (लगमग)	बाल्कनी एरिया वर्गमीटर (लगभग)	बाल्कनी एरिया वर्गफुट (लगभग)	अपार्टमेंट के एलॉटमेंट की दर (सब मिला कर)	आवेदन के साथ बुकिंग की राशि 5%*	एलॉटमेंट पर 20%
2BHK TYPE-1	25	53.29	573.54	8.42	90.59	2499458	120443.4	504421.1
2BHK TYPE-2	25	54.88	590.66	8.2	88.26	2569032	124038.6	518219.4
2BHK TYPE-3	21	53.71	578.13	7.1	76.42	2504566	121407.3	504734.2
2BHK TYPE-4	25	53.65	577.41	8.21	88.4	2513522	121256.1	507124.4
3BHK TYPE-5 (5UNITSFORMQ)	7	59.97	645.46	9.43	101.53	2810932	135546.6	567186.4

*कपर उल्लिखित दर में जीएसटी और अन्य शुल्क जैसे स्टाम्प डवटी, पंजीकरण शुक्ल आदि शामिल नहीं हैं।

देय शेष राशि परियोजना के निर्माण लिंक भुगतान योजना के अनुसार देय राशि के बराबर होगी जैसा कि प्रासंगिक समय पर निर्माण चरण के संदर्भ में लागू होता है

6. पार्किंग	प्रत्येक अपार्टमेंट के लिए दुपहिया वाहन पार्किंग।
7. अपार्टमेंट के बारे में सामान्य विवरण	• फ्लोरिंग : कमरों में विद्रिफाइड टाइल्स, किचन में विद्रिफाइड/सिरामिक टाइल्स, टॉयलेट में एंटी स्किड सिरामिक टाइल्स, बाल्कनी में एंटी स्किड/मैट फिनिश सिरामिक टाइल्स, • खिड़िकयाँ : IS कोड के अनुसार M.S. सेक्शन/अल्युमिनियम पाउडर कोटेड/UPVC • दरवाज़ों के फ्रेम : रेड मरंडी/माइल्ड स्टील/अल्युमिनियम पाउडर कोटेड/UPVC • वॉल टाइल : 4 फुट/७ फुट की ऊँचाई तक सिरामिक टाइल्स एवं कपर ऑयल बाउंड डिस्टेम्पर • किचन काउंटर टॉप ग्रीन मार्बल/ग्रेनाइट • दीवार : ऑयल बाउंड डिस्टेम्पर • किचन काउंटर टॉप ग्रीन मार्बल/ग्रेनाइट • दीवार : ऑयल बांड डिस्टेम्पर • सेनिटरी फिटिंग : ISI मार्क CP फिटिंग्स, W.C. और वॉश बेसिन • इलेक्ट्रिक फिटिंग : ISI मार्क। स्ट्रक्वर : IS कोर्ड और NBC के नवीनतम सुझावों के अनुसार, RCC फ्रेम स्ट्रक्वर को SESMIC फोर्स से बचाव के लिए, डिज़ाइन किया गया है।
8. आवेदन की समय सीमाएँ	 दिनांक 21.10.2022 से ई—ड्रा द्वारा आवास इकाइयों के आवंटन के लिए आवेदन जमा करने के लिए टीसीपी वेबसाइट (https://edraw.tcpharyana.gov.in/tcp-dms/home) पर ऑनलाइन आवेदन करें। अधिक जानकारी के लिए कॉल करें: 7053-121-121 आवेदन पत्र जमा करने की अंतिम तिथि: 04.11.2022 है।

योग्यता : 1. आवेदक पर किसी मौजुदा कानून के तहत कानूनी तौर पर बाध्यकारी करार करने पर रोक नहीं हो। 2. आवेदन कोई भी कर सकता है हालाँकि एलॉटमेंट में प्राथमिकता PMAY (पीएमएवाई) लामार्थियों को दी जाएगी जिनमें आवेदक समेत उनकी पत्नी (या पति) या आश्रित संतान शामिल हैं जिनकी पहचान 'प्रधानमंत्री आवास योजना - सबके लिए आवास' प्रोग्राम के तहत शहरी स्थानीय निकाय विभाग, हरियाणा के तहत की गई हो। पहली प्राथमिकता कथित शहर के पहचान किए गए लाभार्थियों को दी जाएगी। इसके बाद हरियाणा राज्य के अन्य पीएमएवाई लामार्थियों को दी जाएगी। इसके बाद बचे फ्लैट के एलॉटमेंट में ऐसे आवेदक समेत उनकी पत्नी (या पति) या आश्रित संतान को प्राथमिकता दी जाएगी जिनका हड़ा की किसी कॉलोनी / सेक्टर या हरियाणा शहरी क्षेत्र या केंद्र शासित प्रदेश चंडीगढ़ और राष्ट्रीय राजधानी क्षेत्र दिल्ली की किसी लाइसेंस्ड कॉलोनी में अपना फ्लैट / प्लॉट नहीं हो। 3. एक व्यक्ति एक ही आवेदन कर सकता है। इस नीति के तहत सफल कोई भी आवेदक इस नीति के तहत अन्य किसी कॉलोनी में अन्य फ्लैट के लिए आवेदन योग्य नहीं माना जाएगा। यदि कोई आवेदक एक से अधिक कॉलोनी में आवंटन के लिए सफल होता है तो पसंद का केवल एक पलैट चुनना होगा। 4. आवंटन के लिए आवेदन जमा करते समय सहायक शपथ पत्र और पात्रता का प्रमाण पत्र टीसीपी वेबसाइट पर अपलोड करना अनिवार्य है। आवेदक को आईडी प्रूफ और एड्रेस प्रूफ यानी आधार कार्ड और पैन कार्ड भी अपलोड करना होगा।

आवंटन के मानक : 1, अपार्टमेंट का आवंटन एक समिति के सामने लॉट्री से होगा। समिति में उपायुक्त या उनके प्रतिनिधि (न्युनतम हरियाणा लोक सेवा स्तर के अधिकारी), वरिष्ठ नगर नियोजक (सर्कल कार्यालय), संबद्ध जिले के ढीटीपी और संबद्ध कोलोनाइजर के प्रतिनिधि होंगे। 2. लॉटी की तिथि निर्धारित करने के बाद डेवलपर उसी समाचार पत्र में विज्ञापन देंगे जिसमें यह मूल विज्ञापन प्रकाशित होगा। विज्ञापन में आवेदकों को लॉट्टी की तिथि और स्थान के विवरण दिए जाएँगे। 3. मानकों की पूरी जानकारी और आरंभिक जाँच और आवंटन के लिए निर्धारित समय सीमा के लिए आवेदक अफोर्डेबल ग्रुप हाउसिंग पॉलिसी 2013 के विवरण देखें जो 19.08.2013 दिनांकित अधिसूचना सं. PF-27/48921 और उसमें संशोधन में उपलब्ध है। (विवरण विभागीय वेबसाइट tcpharyana.gov.in पर उपलब्ध हैं)।







Signatureglobal (India) Limited | CIN: U70100DL2000PLC104787 Regd. Office: 13th Floor, Dr. Gopal Das Bhawan, 28 Barakhamba Road, Connaught Place, New Delhi-110001 Corp. Office: Ground Floor, Tower A. Signature Tower, South City -1, Gurugram, Haryana-122001 | www.signatureglobal.in

♥ 7053-121-121

Disclaimer: Promoter urges every applicant to inspect the project site and shall not merely rely upon any architectural impression, plan or sales brochure and, therefore, requests to make personal judgment prior to submitting an application for allotment. Unless otherwise stated, all the images, visuals, materials and information contained herein are purely creative/artistic and may not be actual representations of the product and/or any amenities. Further, the actual design may vary in the fit and finished form, from the one displayed above. Journey time shown, if any, is based upon Google Maps which may vary as per the traffic at a relevant point of time. "Rate mentioned above does not include GST and other statutory charges, if applicable, T & C Apply, 1 sq. mt. = 10.7639 sq. ft.

HOME LOAN PARTNER 3 HDFC HOME LOANS HFL

बजाज हाउसिंग फाइनेंस लिभिटेड

निगमित कार्यालयः सेरेब्रम आईटी पार्क बी2 बिल्डिंग, 5वां तल, कल्याणी नगर, पुणे, महाराष्ट्र 411014 शाखा कार्यालयः तृतीय तल, लैंडमार्क टॉवर, जय क्लब के सम्मुख, सी–स्कीम, जयपुर, राजस्थान–302001

अधिग्रहण सूचना प्रतिभूति हित (प्रवर्तन) नियमावली 2002 के नियम 8—(1) के साथ पठित वित्तीय परिसम्पित्तियों के प्रतिभूतिकरण एवं पुनर्निर्माण तथा प्रतिभूति हित प्रवर्तन अधिनियम 2002 की धारा 13(4) के अंतर्गत (परिशिष्ट-IV)

जबिक, अधोहस्ताक्षरकर्ता ने मैसर्स बजाज हाउसिंग फाइनेंस लिमिटेड (बीएचएफएल) के प्राधिकृत अधिकारी के रूप में वित्तीय परिसम्पत्तियों के प्रतिभूतिकरण एवं पुनर्निर्माण तथा प्रतिभूति हित प्रवर्तन अधिनियम 2002 के अंतर्गत और प्रतिभूति हित (प्रवर्तन) नियमावली 2002 के नियम 3 के साथ पिठत उक्त अधिनियम की धारा 13(2) के अंतर्गत प्रदत्त शक्तियों के प्रयोगान्तर्गत, मांग सूचना(एं) यहां इसमें निम्न वर्णित ऋणकर्ता(ओं) / सह-ऋणकर्ता(ओं) / गारंटर(रों) को निर्गत की थीं जिनमें उन्हें सूचना में अंकित राशि का उक्त सचना की प्राप्ति की तिथि से 60 दिवसों के अंदर प्रतिभगतान करने को कहा गया था ऋणकर्ता(गण) / सह—ऋणकर्ता(गण) / गारंटर(गण) राषि का प्रतिभुगतान करने में विफल हो चुके हैं, अतएव एतद्द्वारा ऋणकर्ता(ओं) / सह-ऋणकर्ता(ओं) / गारंटर(रों) को तथा जनसाधारण को सचित किया जाता है कि अधोहस्ताक्षरकर्ता ने मैसर्स बजाज हाउसिंग फाइनेंस लिमिटेड की ओर से यहां इसमें निम्न विवरणित सम्पत्ति का, उक्त नियमावली के नियम 8–(1) के साथ पठित उक्त अधिनियम की धारा 13(4) के अंतर्गत उनको प्रदत्त षिक्तयों के प्रयोगान्तर्गत, अधिग्रहण कर लिया है ऋणकर्ता(ओं) / सह-ऋणकर्ता(ओं) / गारंटर(रों) को विषेष रूप में तथा जनसाधारण को एतद्द्वारा सामान्य रूप में सावधान किया जाता है कि निम्न वर्णित सम्पत्ति का लेन–देन न करें तथा उक्त सम्पत्ति का कोई व किसी भी प्रकार का लेन–देन, यहां इसमें निम्नांकित अनुसार राशि(यों) तथा इन राशियों पर भावी ब्याज हेतु बीएचएफएल के प्रभाराधीन होगा।

ऋणकर्ता(ओं) / गारंटर(रों) के नाम (एलएएन नं., शाखा का नाम)	प्रतिभूत परिसंपत्ति (अचल संपत्ति) का विवरण	मांग सूचना तिथि एवं राशि	अधिग्रहण र्कं तिथि
शाखा : नागौर (लैन नंबर H4J8FLP0374196 एवं H4J8FLP0374197) 1. फकरुद्दीन पुत्र निजामुद्दीन (ऋणकर्ता) 2. खुर्शीदा बेगम (सह—ऋणकर्ता) उपरोक्त दोनों यहां के निवासी : खिचियो की पोल	निम्नानुसार विवरणित गैर—कृषि संपत्ति के समस्त वह भाग तथा अंशः वार्ड सं. 20 गांधी चौक मोहल्ला खिचियो की पोल, गांधी चौक के निकट, वाटर टैंक बी रोड, नागौर तहसील नागौर, राजस्थान—341001, परिसीमन : पूर्व— रास्ता, पश्चिम— राशिद खान का मकान, उत्तर— गली, दक्षिण— रास्ता	24 मई 2022 रु. 46,09,668/- (रुपये छियालिस लाख नौ हजार छह सौ अड़सठ मात्र)	17.10.2022
शाखा : कोटपुतली (लैन नंबर H6Y7RLP0174993) 1. रवींद्र कुमार (ऋणकर्ता) 2. निरंजन लाल शर्मा (मृतक होने के बाद से विधिक उत्तराधिकारियों के माध्यम से) (सह—ऋणकर्ता) उपरोक्त दोनों यहां के निवासी : 373, बड़ा मोहल्ला, नमराना, तहसील बहरोर, जनपद अलवर—301705	निम्नानुसार विवरणित गैर—कृषि संपत्ति के समस्त वह भाग तथा अंशः वार्ड सं. ८ वीपीओ नीमराना ग्राम पंचायल नीमराना तहसील नीमराना जनपद अलवर नीमराना, राजस्थान—301705, परिसीमन : पूर्व— श्री हरीश शर्मा की दूकान, पश्चिम— रास्ता, उत्तर— श्री सूरजभान का मकान, दक्षिण— माजरी मार्ग	24 मई 2022 रु. 13,83,724/- (रुपये तेरह लाख तिरासी हजार सात सौ चौबीस मात्र)	18.10.2022

INEOS STYROLUTION

Driving Success. Together.

2

Name of the

Target Company (TC)

Details of the Offer

INEOS STYROLUTION INDIA LIMITED

CIN: L25200GJ1973PLC002436

Regd. Office: 5th Floor, OHM House - II, OHM Business Park, Subhanpura, Vadodara - 390 023. Tel. No.: +91 265 2303201 / 2303202

E mail: INSTY.secshare@ineos.com Website: www.ineosstyrolutionindia.com Recommendations of the Committee of Independent Directors (IDC) of INEOS Styrolution India Limited

("Target Company") on the Open Offer (hereinafter defined) made by Shiva Performance Materials Private Limited ("Acquirer") together with Geetganga Investment Private Limited ("PAC 1"), Mr. Rakesh Agrawal ("PAC 2") and Mr. Rahul Agrawal ("PAC 3") (PAC 1, PAC 2 and PAC 3 collectively to be referred as "PACs"). in their capacity as the persons acting in concert with the Acquirer, to the public shareholders of the Target Company, under Regulation 26(7) of the Securities and Exchange Board of India (Substantial Acquisition of Shares and Takeovers) Regulations, 2011 and subsequent amendments thereto ("SEBI (SAST) Regulations"). October 20, 2022 Date

Open offer for acquisition of up to 45,72,263 fully paid-up equity shares of face value of

INEOS Styrolution India Limited

3,	pertaining to TC	INR 10 each ("Equity Shares") from the Public Shareholders of the Target Company, representing 26.00% of the Voting Share Capital of the Target Company on a fully diluted basis as on the 10th working day from the closure of tendering period, at a price of INR 848.72 per Equity Share (the "Offer Price") aggregating to total consideration of up to INR 388,05,71,054 (assuming full acceptance) payable in cash. The public announcement dated August 1, 2022 ("PA"), the detailed public statement published on August 5, 2022 ("DPS"), the draft letter of offer dated August 10, 2022 ("DLOF"), and the letter of offer dated October 17, 2022 ("LOF") have been issued by JM Financial Limited on behalf of the Acquirer and the PACs.
4.	Name(s) of the acquirer and PAC	Acquirer: Shiva Performance Materials Private Limited PACs: Geetganga Investment Private Limited (PAC 1) Mr. Rakesh Agrawal (PAC 2); and Mr. Rahul Agrawal (PAC 3).
5.	Name of the Manager to the offer	JM Financial Limited 7th Floor, Cnergy, Appasaheb Marathe Marg, Prabhadevi, Mumbai - 400 025. Tel:+91 22 6630 3030 Fax:+91 22 6630 3330 Contact person: Ms. Prachee Dhuri Email: ineos.openoffer@jmfl.com SEBI registration no.: INM000010361
6.	Members of the Committee of Independent Directors (Please indicate the chairperson of the Committee separately)	Mr. Vinesh Sadekar (Chairperson) Ms. Sandra Martyres (Member)
7.	IDC Member's relationship with the TC (Director, Equity shares owned, any other contract / relationship), if any	The members of the IDC are independent directors on the board of directors of the Target Company. None of the members of the IDC hold any Equity Shares/ securities of the Target Company. Except as mentioned below, none of the members of the IDC have entered into any contract or have any relationship with the Target Company: a. Mr. Vinesh Sadekar is the chairperson of the Audit Committee, the Nomination and Remuneration Committee and Risk Management Committee of the Target Company, and is a member of the Corporate Social Responsibility Committee of the Target Company; and b. Ms. Sandra Martyres is the chairperson of the Stakeholders Relationship and Grievance Committee and the Corporate Social Responsibility Committee of the Target Company, and is a member of the Audit Committee and the Nomination & Remuneration Committee of the Target Company.
8.	Trading in the Equity shares / other securities of the TC by IDC Members	None of the members of the IDC have traded in any of the Equity Shares / securities of the Target Company during the: a. 12 months period preceding the date of the PA; and b. period from the date of the PA and till the date of this recommendation.
9.	IDC Member's relationship with the acquirer (Director, Equity shares owned, any other contract/ relationship), if any.	None of the members of IDC: a. are directors on the boards of the Acquirer or the PACs; b. hold any equity shares or other securities of the Acquirer or the PACs; and c. have any contracts/ relationship with the Acquirer or the PACs.
10.	Trading in the Equity shares / other securities of the acquirer by IDC Members	None of the members of the IDC have traded in any of the equity shares/ securities of the Acquirer or the PACs during the: a. 12 months period preceding the date of the PA; and b. period from the date of the PA and till the date of this recommendation.
11.	Recommendation on the Open offer, as to whether the offer is fair and reasonable	The IDC is of the opinion that the Offer Price of Rs. 848.72 (Indian Rupees Eight hundred forty-eight and paise seventy two only) per Equity Share offered by the Acquirer is (a) in accordance with the applicable regulations under the SEBI (SAST) Regulations, and (b) accordingly, the Open Offer appears to be fair and reasonable. However, IDC would like to point out that the share price of the company is

15. Any other matter(s) to be highlighted To the best of our knowledge and belief, after making proper enquiry, the information contained in or accompanying this statement is, in all material respects, true and correct and not misleading, whether by omission of any information or otherwise, and includes all the information required to be disclosed by the Target Company under the SEBI (SAST)

provide its independent opinion with respect to the Offer Price

The IDC has reviewed the PA, the DPS, and the LOF.

dynamic in nature and is subject to daily fluctuations and change. The closing share

price (as at the end of day October 19, 2022) of the Target Company on the NSE was

The shareholders are advised to independently evaluate the open offer and take an

Further, Shailesh Haribhakti& Associates, Chartered Accountants, appointed by the

IDC to provide its independent opinion, has confirmed that the Offer Price of Rs.

848.72 (Indian Rupees Eight hundred forty-eight and paise seventy two only) per

Equity Share is in accordance with the Regulation 8(2) of the SEBI (SAST)

Regulations and opined that the Offer Price of 848.72 (Indian Rupees Eight hundred

In view of the above, the IDC has set out its recommendation in paragraph 11 above.

This statement of recommendation will also be available on the website of the Target

https://www.ineosstyrolutionindia.com/INTERSHOP/web/WFS/Styrolution-India-

Site/en_US/-/USD/ViewContent-Start?PageletEntryPointID=investors-investor-

Shailesh Haribhakti & Associates, Chartered Accountants, appointed by the IDC to

informed decision, whether or not to tender their equity shares in the open offer.

forty eight and paise seventy two only) per Equity Share is fair and reasonable.

The recommendation was unanimously approved by the members of the IDC

For and on behalf of the Committee of the Independent Directors of INEOS Styrolution India Limited

DIN: 00046815

Vinesh Sadekar Chairperson - Committee of Independent Directors

www.readwhere.com

दिनांक : 20.10.2022







INR 839.40.

Summary of reasons for

Details of voting pattern

Details of Independent

Advisors, if any.

Regulations.

Place: Mumbai

Date: October 20, 2022

recommendation



शाखा कार्यालय: आयसीआयसीआय बँक लिमिटेड, तळ मजला, आक्रुती सेंटर, एमआयडीसी टेलिफोन एक्सचेंज जवळ, आक्रती स्टारच्या समोर, अंधेरी पूर्व, मुंबई - ४०००९३

जाहीर सूचना – तारण मत्तेच्या विक्रीसाठी निविदा ई– लिला (नियम ८(६) चे तरतुदीकडे पहा)

स्थावर मिळकतीच्या विक्रीकरिता सूचना

सिक्यरीटायझेशन अँड रिकन्स्टक्शन ऑफ फायनान्शियल असेटस अँड एन्फोर्समेंट ऑफ सिक्यरिटी इंटरेस्ट कायदा २००२ सह नियम ८(६) च्या तरतुदीनुसार स्थावर मालमत्तेचा ई–लिलाव विक्री सूचना.

सर्वेसामन्य लोक आणि विशेषतः कर्जदार आणि जामीनदार यांना सूचना देण्यात येत आहे की खाली वर्णन केलेली स्थावर मालमत्ता जी सिक्युअर्ड क्रेडीटर यांच्याकडे गहाण/ चार्ज्ड करण्यात आली असुन, त्याचा प्रत्यक्ष ताबा आयसीआयसीआय बँक लि.चे अधिकारी यांनी घेतला असून ती ''जसे आहे जिथे आहे'' ''जे आहे ते आहे '', आणि ''तेथे जे असेल ते '' या आधारे होणार आहे, त्याचे तपशील खाली देण्यात आले आहेत.

		- '				-
	न. कर्जदाराचे / सह. ठ. कर्जदाराचे /	काही असल्यास ज्ञात बोजासह तारण मत्तेचा तपशील	थकबाकी रक्कम	आरक्षित मूल्य (₹)	मालमत्तेच्या परीक्षणची	ई-लिलाव तारीख
	हमीरदाराचे नाव /		₹	इसारा अनामत ठेव	तारीख आणि वेळ	आणि वेळ
	कर्ज खाते क्रमांक			अनामत ठव	आाण पळ	4∞
(1	१) (बी)	(सी)	(륑)	(ई)	(एफ)	(जी)
1	. श्री माळी योगेश नामदेव	कार्यालय. क्रमांक- ६०२, सहावा मजला	₹	₹	ऑक्टोबर	नोव्हेंबर
	(कर्जदारचे) आणि श्रीमती	(०६ वा मुज्ला), सेंट्रल फॅसिलिटी बिल्डिंग,	८०,६४, ०८५/-	५९,००,	२८,२०२२	११,२०२२
	शीतल योगेश माळी	वाशी – तुर्भे रोड, जवळ: एपीएमसी फळे		000/-	सकाळी	सकाळी
	कर्ज खाते क्रमांक	आणि भाजी मार्केट, प्लॉट क्रमांक- ३, आणि ७, गॅट. क्रमांक- ७९६, सेक्टर-	(दि. ऑक्टोबर	₹	११:०० ते दुपारी	११:००
	LBMUM00005311903	१९, गावः वाशी / तुर्भे, नवी मुंबई.	१८, २०२२	५,९०,	05:00	पासून
		मोजमापित बिल्ट अप क्षेत्र ५७० चौरस फूट	(पर्यंत)	000/-	पर्यंत	
1 1	1		I	I	1	1

ऑनलाईन लिलाव युआरएल लिंक- (URL Link-https://disposalhub.com) में. नेक्सझेन सोल्यूशन्स प्रायहेट लिमिटेड. या ई-लिलाव एजन्सीच्या वेबसाईटवर आयोजित करण्यात येईल. तारणदार/नोटीसी यांना **दि. नोव्हेंबर १०, २०२२** रोजी **संघ्याकाळी ५.००** वाजणेपूर्वी एकूण थकबाकी आणि पुढील व्याजासह रक्कम परतफेड करण्याची संधी देण्यात येत आहे. अन्यथा सदर तारण मालमत्तावरील परिशिष्टाप्रमाणे विक्री करण्यात येईल.

संभाव्य बोलीदारांनी बयाणा रक्कम (ईएमडी) **आयसीआयसीआय बँक लिमिटेड, लेवल ३-५, ७४ टेक्नो पार्क, सीप्झ गेट क्रमांक ०२** समीय बालादाराना बयाणी रक्कम (इएमडा) आयसाआयसाआय बका लामटड, लवल ३-५, ७४ टक्ना पाक, साध्य गट क्रमाक ०२ समोर, मरोल एमआयडीसी, अंधेरी पूर्व, मुंबई ४०००९३ यांचेकडे डीमांड ड्राफ्ट (डीडी) (कॉल्फम ई पहा) दि. नोट्हेंबर १०, २०२२ रोजी दु. ०२.०० वाजणेपूर्वी सादर करावी आणि त्यानंतर त्यांनी त्यांचा प्रस्ताव फक्त वर नमूद वंबसाईटमार्फत दि. नोट्हेंबर १०, २०२२ रोजी संध्याकाळी ५.०० वाजणेपूर्वी ईएमडीच्या पैसे भरल्याच्या पुराव्यासाठी बँक पोचसह डीडीची स्कॅन केलेल्या ईमेजसह सादर करणे आवश्यक आहे. कृपया नोंद घ्यावी, जर संभाव्य बोलीदारांना वेबसाईटमार्फृत त्यांचे प्रस्ताव सादर करणे शक्य नसल्यास, स्वाक्षरीकृत निविदा जारताजाची प्रत आयसीआयसीआय बँक लिमिटेड, लेवल ३-५, ७४ टेक्नो पार्क, सीच्झ गेट क्रमांक ०२ समोर, मरोल एमआयडीसी, अंधेरी पूर्व, मुंबई ४०००९३ येथे दि. नोव्हेंबर १०, २०२२ रोजी संध्याकाळी ५.०० वाजणेपूर्वी सादर करता येतील. बयाणा रक्कम राष्ट्रीयकृत/वर्गीकृत बँकेकडील डीडी/पीओ ''आयसीआयसीआय बँक लिमिटेड यांच्या नावे मुंबई येथे देय सादर करावा.

पाहणीसंबंधित, ई-लिलावाच्या शर्ती व अटी किंवा निविदा सादर करण्याशी संबंधित कोणत्याही खुलाशाकरिता कृपया संपर्क आयसीआयसीआय बँक लिमिटेडला ८४५४०८९३५३/ ७३०४९१५५९४/ ८२९१९५८७६५ वर संपर्क कर

कृपया नोंद घ्यावी की मार्केटिंग एजन्सी **१. मेसर्स नेक्सझेन सोल्यूशन्स प्रायव्हेट लिमिटेड २. ऑजीओ ॲसेट मॅनेजमेंट प्रायव्हेट लिमिटेड ३. मॅटेक्स नेट प्रायव्हेट लिमिटेड** यांनादेखील सदर मालमत्तेच्या विक्री सुविधेसाठी नेमण्यात आले आहे.

कोणतेही कारण न देता कोणतीही किंवा सर्व बोली स्विकारणे किंवा नाकारणेचा अधिकार प्राधिकृत अधिकाऱ्यांकडे राखीव आहे. विक्रीच्य विस्तृत शर्ती व अटींकरिता कृपया भेटा,https://www.icicibank.com/n4p4s.

दिनांक : ऑक्टोबर २१, २०२२ ठिकाण : मुंबई

प्राधिकृत अधिकारी आयसीआयसीआय बँक लिमिटेड ु



एयु स्मॉल फायनान्स बँक लिमिटेड

(शेड्युल्ड कमर्शियल बँक) (सीआयएन: एल३६९११आरजे१९९६पीएलसी०११३८१)

नोंदणी कार्यालय: १९-ए, धुलेश्वर गार्डन, अजमेर रोड, जयपूर-३०२००१

परिशिष्ट IV [नियम ८ (।) पहा)] कब्जा सूचना (स्थावर मिळकतीकरिता)

ज्याअर्थी, निम्नस्वाक्षरीकारांनी **एयु स्मॉल फायनान्स बँक लिमिटेड (शेड्युल्ड कमर्शियल बँक)** चै पाधिकत अधिकारी म्हणन सिक्यरिटायझेशन अँड रिकन्स्टक्शन ऑफ फायनान्शिअल ॲसेटस अँड एन्फोर्समेंट ऑफ सिक्युरिटी इंटरेस्ट (ॲक्ट, २००२ (५४ सन २००२) अन्वये आणि कलम १३(१२) सहवाचता सिक्यरिटी इंटरेस्ट (एन्फोर्समेंट) रूल्स, २००२ चा (नियम ३) अन्वये प्रदान केलेल्या अधिकाराचा वापर करून सदर सूचनेच्या तारखेपासून ६० दिवसात रु. १८,७७,९१९/- (रुपये अठरा लाख सत्त्याहत्तर हजार नऊशे एकोणीस मात्र) अशी सूचनेत नमूद केलेली रक्कम चुकती करण्यासाठी कर्जदार राजेश किष्णन (कर्जदार), सुरेखा राजेश (सह-कर्जदार), (कर्ज खाता क्र एल९००१०६०११४३४६७३१) यांना बोलाविण्यासाठी दिनांक १२-जुलै-२२ रोजीची मागणी सूचन

कर्जदार/गहाणवटदार यांनी रक्कम चुकती करण्यामध्ये कसूर केलेली आहे, म्हणून कर्जदार/गहाणवटदा आणि सर्वसाधारण जनतेस याद्वारे सूचना देण्यात येते की, निम्नस्वाक्षरीकारांनी सदर १५ ऑक्टोबर २०२२ रोजी सदरह अधिनियमाचे कलम १३ च्या पोटकलम (४) सहवाचता सिक्युरिटी इंटरेस्ट एन्फोर्समें कलम २००२ च्या नियम / अन्वये त्याला /तिला पटान केलेल्या अधिकाराचा वापर करून यात याखाल वर्णन केलेल्या मिळकतीचा कब्जा घेतलेला आहे.

विशेषतः कर्जदार/गहाणवटदार आणि सर्वसामान्य जनता यांना यादारे सावधान करण्यात येते की. त्यांनी सदरह् मिळकतीच्या देवघेवीचा व्यवहार करू नये आणि सदरह् मिळकतीवरील कोणताही देवघेवीचा व्यवहार हा १२-जुलै-२२ रोजीसची रु. १८,७७,९१९/- (रुपये अठरा लाख सत्त्याहत्तर हजार नऊशे एकोणीस मात्र) आणि संपूर्ण प्रदानापर्यंत त्यावरील व्याज आणि खर्च या रकमेकरिता एयु स्मॉल **फायनान्स बँक लिमिटेड (शेड्युल्ड कमर्शियल बँक)**च्या प्रभाराच्या अधीन राहील.

कर्जदारांचे लक्ष तारण मत्ता विमोचनासाठी उपलब्ध वेळेच्या संदर्भात अधिनियमाच्या कलम १३ च्य पोटकलम (८) च्या तरतुर्दीकडे वेधण्यात येत आहे.

स्थावर मिळकतीचे वर्णन

रहिवासी/कमर्शियल मिळकत जिमन/बिल्डिंग/रचना आणि फिक्चर्सचे सर्व ते भाग येथे स्थित, मिळकत स्थित यथे फ्रीहोल्ड पालिका हद्दीत शॉप क्र. ९, तळमजला, ए विंग, नागी पॅलेस जुना सर्व्हें क्र. १७७, नवीन सर्व्हें क्र. ६५, हिस्सा क्र. १५, भाईंदर, ठाणे, महाराष्ट्र.मोजमापित ११५ चौ.फू. राजेश क्रिष्णन आणि सुरेखा राजेश क्रिष्णन यांच्या मालकीचे

दिनांक: १५/ऑक्टो/२०२२ ठिकाण: ठाणे, महाराष्ट्र.

प्राधिकृत अधिकारी एयु स्मॉल फायनान्स बँक लिमिटेड

PUBLIC NOTICE

Notice is issued to inform all the public that Mrs. Susheela Appu Shetty was the owner of Flat No. B-101, 1st Floor, Neptune Co-Operative Housing Society Limited, Vasant Galaxy, New Link Road, Goregaon (West), Mumbai- 400104, society registration No. MUM/W-HSG/TC/12200/2003-04, and was olding society share certificate No. 086 for fully paid-up shares, bearing number from 61 to 165 (both inclusive). The said Mrs. Susheela Appu Shetty has expired on 2/04/2022 leaving behind her only legal eirs Nominees Mr. Ganesh Appu Shetty Son), Mrs. Surekha Uday Shetty Daughter), Mrs. Rekha Harish Shetty Daughter), Mrs. Sukeshini Satish Shetty daughter) claimants of her estate any person/s, firm, authorities, other lega

neirs, representative having any claim, right, title, benefit, and /or interest whatsoever in respect of the said flat or any part thereof by way of sale, exchange assignment, lease, Gift, Mortgage rasement, will, or otherwise however are ereby required to make the same known in vriting, along with true copies of all such documents in support thereof to me at my office add: D-1/B, Kumud Nagar, S. V. Road, Near Cinemax Theatre, Goregaor W), Mumbai – 400104, within (15) Fifteer ays from the date of publication hereof ailing which all such claims, rights, title, enefits and/or interests, if any, shall be onsidered to have been waived and /or bandoned with this notice, and my clients shall have full rights to complete the transfe

Place: Mumbai

Date: 21/10/2022 Sanjay Kumar Tiwari

(Advocate High Court)

परिशिष्ट IV (नियम 8(1) पहा) ताबा सूचना

निम्नस्वाक्षरीकार **इंडियाबुल्स हाउसिंग फायनान्स लिमिटेडचे(CIN:L65922DL2005PLC136029)** सेक्योरिटाइजेशन ऑफ फायनांशियल असेट्स ॲण्ड रिकन्स्ट्रक्शन ऑफ फायनांशियल असेट्स ॲण्ड न्फोर्समेन्ट ऑफ सिक्युरिटी इंटरेस्ट ॲक्ट, 2002 अन्वये प्राधिकृत अधिकारी आणि सदर सूचना प्राप्त माल्याच्या दिनाकापासून स्पष्ट 60 दिवसांच्या आत **20.05.2022** रोजी सूचनेत नमूद केलेली आणि अधिक रक्कम रू. 19,80,016.83/- (एकोणीस लाख ऐंशी हजार सोळा रूपये आणि त्र्याऐंशी पैसे फक्त) साठी कर्ज खाते क्र. HHLVSH00433341 या रकमेची परत फेड करण्याची दिनांक 17.05.2022 पासून ते प्रत्यक्ष भरणा करेपर्यंतची मागणी, सूचना कर्जदार **शर्मिला सनिल मोहिते आणि सुनिल मारुती मोहिते** याना कलम 13(12) सह सिक्युरिटी इंटरेस्ट (एन्फोर्समेन्ट) रूल्स, 2002 चा . नियम 3 अन्वये प्राप्त झालेल्या अधिकारात जारी केली.

प्तदर रकमची परत फेड करण्यात कर्जदार अपयशी ठरल्यामुळे याद्वारे कर्जदार आणि सर्व सामान्य जनतेला सूचना देण्यात येते की, सदर कायद्याचे कलम 13 ची उप कलम (4) सह सिक्युरिटी इंटरेस्ट . (एन्फोर्समेन्ट) रूल्स, 2002 चा नियम 8 अन्वये प्राप्त झालेल्या अधिकारात खाली वर्णन केलेल्य गलमतेचा निम्न स्वाक्षरीकाराने **प्रतिकात्मक ताबा 17,10,2022** रोजी घेतलेला आहे.

विशेषतः कर्जदार आणि सर्वसामान्य जनतेला यादारे खबरदार करण्यात येते की. या मालमत्तेचे व्यवहार करू नयेत आणि कोणत्याही व्यवहारावर **इंडियाबुल्स हाउसिंग फायनान्स लिमिटेड** ची कर्ज आकारणी रू. 19,80,016.83/- (एकोणीस लाख ऐंशी हजार सोळा रुपये आणि त्र्याऐंशी पैसे फक्त) पूढील व्याज 17.05.2022 पासून प्रत्यक्ष भरणा करेपर्यंत लागेल.

कर्जदारांचे लक्ष्य कलम 13 चे उप - कलम (8) च्या मालमत्ता / मालमत्तेला मुक्त करण्यासाठी उपलब्ध वेळेकडे आकर्षित केले जात आहे.

स्थावर मालमत्तेचे वर्णन

27.796 चौ.मीटर (299.20 चौ. फू. शी समतुल्य) कार्पेट क्षेत्र असलेला 3 ऱ्या मजल्यावरील फ्लॅट क्र. 301, बिल्डिंग क्र. 1 मध्ये, 4.878 चौ. मीटर + 6.008 चौ. मी. मोजमाप असलेल्या जोडलेल्या बाल्कनीसह, अनुमानीत बाल्कनी रियल इस्टेट प्रकल्पात असून 'श्रमिक वैभव' या नावाने ओळखले गणाऱ्या प्रमोटर्सनी बाधले आहे, लॅंड बिअरिंग गट क्र. 122 हिस्सा क्र. 0 वर बाधकाम केले आहे, शेडुंग गाव येथे वसलेले, ता. पनवेल, जि. रायगड, महाराष्ट्र 410206, पनवेल, एक कव्हर्ड कार

तारीख: 17.10.2022 स्थळ : रायगड

अधिकृत अधिकारी इडियाब्ल्स हाउसिंग फायनान्स लिमिटेड

परिशिष्ट IV (नियम 8(1) पहा) ताबा सूचना

नेम्नस्वाक्षरीकार **इंडियाबुल्स हाउसिंग फायनान्स लिमिटेडचे(CIN:L65922DL2005PLC136029)** सेक्योरिटाइजेशन ऑफ फायनाशियल असेट्स ॲण्ड रिकन्स्टक्शन ऑफ फायनाशियल असेट्स ॲण्ड एन्फोर्समेन्ट ऑफ सिक्युरिटी इंटरेस्ट ॲक्ट, 2002 अन्वये प्राधिकृत अधिकारी आणि सदर सूचना प्राप्त झाल्याच्या दिनाकापासून स्पष्ट 60 दिवसाच्या आत 15.06.2022 रोजी सूचनेत नमूद केलेली आणि अधिक रक्कम रू. 40.92.844.39/- (चाळीस लाख ब्याण्णव हजार आठशे चव्वेचाळीस रुपये आणि ए**कोणचाळीस पैसे फक्त)** साठी कर्ज खाते क**. HHLLOW00391606** या रकमेची परत फेड करण्याची दिनाक 14.06.2022 पासून ते प्रत्यक्ष भरणा करेपर्यंतची मागणी, सूचना कर्जदार अमरसिंह पी खालसा आणि रेश्मा प्रकाश चंदका याना कलम 13(12) सह सिक्युरिटी इंटरेस्ट (एन्फोर्समेन्ट) रूल्स, 2002 चा नियम 3 अन्वये प्राप्त झालेल्या अधिकारात जारी केली.

सदर रकमची परत फेड करण्यात कर्जदार अपयशी ठरल्यामुळे याद्वारे कर्जदार आणि सर्व सामान्य जनतेला सूचना देण्यात येते की, सदर कायद्याचे कलम 13 ची उप कलम (4) सह सिक्युरिटी इंटरेस्ट (एन्फोर्समेन्ट) रूल्स, 2002 चा नियम 8 अन्वये प्राप्त झालेल्या अधिकारात खाली वर्णन केलेल्या गलमतेचा निम्न स्वाक्षरीकाराने **प्रतिकात्मक ताबा 17.10.2022** रोजी घेतलेला आहे.

विशेषतः कर्जदार आणि सर्वसामान्य जनतेला याद्वारे खबरदार करण्यात येते की, या मालमत्तेचे व्यवहा करू नयेत आणि कोणत्याही व्यवहारावर **इंडियाबुल्स हाउसिंग फायनान्स लिमिटेड** ची कर्ज आकारणी रू. 40,92,844.39/- (चाळीस लाख ब्याण्णव हुजार आठशे चव्वेचाळीस रुपये आणि एकोणचाळीस

पैसे फक्त) पुढील व्याज 14.06.2022 पासून प्रत्यक्ष भरणा करेपर्यंत लागेल. कर्जदारांचे लक्ष्य कलम 13 चे उप - कलम (8) च्या मालमत्ता / मालमत्तेला मुक्त करण्यासाठी उपलब्ध वेळेकडे आकर्षित केले जात आहे.

स्थावर मालमत्तेचे वर्णन

फ्लॅट क्र. 19, बी विंग, तळ मजला, 431 चौ. फू. एवढे कार्पेट क्षेत्र, बिल्डिंग क्र. 6 मध्ये, प्रेम प्रकाश कॉपरेटिव्ह हाऊसिंग सोसायटी लिमिटेड येथे वसलेले, प्लॉट क्र. 5, 6 आणि 7 येथे स्थित असलेले, लक्ष्मी कॉलनी, माहुल रोड, आर सी. मार्ग, चेंबूर, मुंबई - 400074, महाराष्ट्र, वडवली गावाचा अतिम प्लॉट बिअरिंग सीटीएस क्रमांक 267, तालुका कुर्ला, मुंबई उपनगर जिल्हा, बृहन्मुंबई

तारीख: 17.10.2022 स्थळ : मुबई

अधिकृत अधिकारी इंडियाबुल्स हाउसिंग फायनान्स लिमिटेड

फिनिक्स एआरसी प्रायव्हेट लिमिटेड नों. कार्यालय: दानी कॉर्पोरेट पार्क, ५ वा मर्जला, १५८, सी.एस.टी. रोड, किलना, सांताक्रुझ (पू.), मुंबई-४०० ०९८ फोन : ०२२-६८४९२४५०, फॅक्स : ०२२-६७४१ २३१३, सीआयएन: यु६७१९० एमएच२००७ पीटीसी१६८३०३

ई-मेल : info@phoenixarc.co.in, वेबसाईट : www.phoenixarc.co.in; https://phoenixarc.co.in?p=2563

मालमत्तेची ऑनलाईन ई-लिलाव विक्री

ऑनलाईन ई-लिलावाकरिता जाहीर सूचना

सिक्युरिटायझेशन अँड रिकन्स्ट्रक्शन ऑफ फायनान्शिअल ॲसेटस् अँड एन्फोर्समेंट ऑफ सिक्युरिटी इंटरेस्ट ॲक्ट, २००२ (संक्षिप्त स्वरुपात सरफैसी ॲक्ट) आणि **सिक्यरिटी इंटरेस्ट (एन्फोर्समेंट) रुल्स, २००२ (संक्षिप्त स्वरुपात रुल्स)** अन्वये प्रदान केलेल्या अधिकाराचा वापर करून आणि तारण कर्जाच्या वसलीकरिता सदर सरफैसी ॲक्ट आणि रुत्स अन्वये प्राधिकृत अधिकाऱ्यांकडे निहित येथील खालील नमूद तारण मत्तेच्या कब्जाला अनुसरून प्राधिकृत अधिकाऱ्यांनी लिलाव विक्रीद्वारे तारण मत्तेची विक्री करण्याचे

ार्वसामान्य जनता आणि विशेषतः कर्जदार आणि हमीदार यांना सूचना याद्वारे देण्यात येते की, खालील नमुद मिळकत हि (दिनांक २८.०३.२०१४ रोजीच्या अभिहस्तांकन करारा द्वारे फिनिक्स च्या नावे सारस्वत को–ऑपरेटिव्ह बँक लिमिटेड द्वारे कर्जाच्या अभिहस्तांकनानुसार) फिनिक्स ट्रस्ट एफवाय १४-१३ स्किम ए (यानंतर फिनिक्स असा उद्घेख) चे ट्रस्टी म्हणू-त्यांच्या क्षमतेत कार्यरत फिनिक्स एआरसी प्रायव्हेट लिमिटेड कडे गहाण आहे. ती खालील दिलेल्या तपशिलानुसार वेबसाईट https://www.bankeauctions.com द्वारे सस्फैर्स अंबर सहवाचता नियमावलीच्या नियम ८ आणि ९ च्या तस्तुर्दीनुसार खालील तपशिलानुसार थकवाकी आणि पुढील व्याज, प्रभार, खर्च इ. च्या वसुलीसाठी ''ऑनलाईन ई–लिलाव च्या मागनि ''जे आहे जेथे आहे'', ''जे आहे जसे आहे'' आणि ''जे काही आहे तेथे आहे'' अटींवर विकण्यात येणार आहे.

कर्जदाराचे नाव	आयव्हीएफ क्राफ्ट इंडिया प्रायव्हेट लिमिटेड				
वैयक्तीक हमीदार/ कॉर्पोरेट	१. डॉ. सतिश शर्मा, २. डॉ. राजीव शर्मा,				
हमीदार यांचे नाव	३. आशा रविंद्र चांद, ४. रविंद्र रूपनारायण चांद				
	५. रूपनाराय	ण चांद (मयत)			
थकीत रक्कम	ह. १२,५४,६६,८७२.४१/- (रुपये बारा कोटी चोपन्न लाख सहासष्ट हजार आठशे बहात्तर आणि पैसे एकेचाळीस मात्र)				
		२ रोजीस सह सरफैसी ॲक्ट, २००२ च्या र		.२०१२ दिनांकीत मागणी सूचनेनुसार	
	सांपार्श्विक द	राने पुढील व्याज सह अनुषंगिक खर्च, परिव	यय, प्रभार इ.		
सरफैसी ॲक्ट २००२ अन्वये	तारण मत्तेचा प्र	ात्यक्ष कब्जा २२.०४.२०१३ रोजीस सारस्वत व	nì-ऑपरेटिव्ह बँक लिमिटेड च्या प्राधिः	कृत अधिकाऱ्यांद्वारे घेतला आणि त्यांनतर	
कब्जा	१६.०५.२०१४ रोजीस फिनिक्सच्या प्राधिकृत अधिकाऱ्यांना सुपुर्द केला.				
निरिक्षणाची तारीख	०२.११.२०२२ (बुधवार) स. ११.०० ते दु. १.०० दरम्यान				
बोली (ई-लिलाव)	84.88.202	२ (मंगळवार) दु. ४.३० पूर्वी			
सादरीकरणाची तारिख					
इसारा अनामत रक्कम	इ.अ.र. रक्कम आरटीजीएसच्या मार्गे फिनिक्स ट्रस्ट एफव्हाय१४-१३ स्किम ए, चालू खाते: ६१११४११७२८; सीआरएन क्र.				
(इ.अ.र)		, कोटक महिंद्रा बँक लिमिटेड, शाखा: कलि		(BK0000६३१.	
		ा: रु. १६,०१,८००/- (रुपये सोळा लाख ए			
राखीव किंमत	रु. १,६०,१८,०००/- (रुपये एक करोड साठ लाख अठरा हजार मात्र)				
बोली वाढविणे	रु. ५०,०००/- (रुपये पन्नास हजार मात्र) आणि तशा पटीने.				
ई-लिलावाची तारीख	१६.११.२०२२ (बुधवार) स. ११.०० ते दु. १२.०० वा.				
ई-लिलावाचा प्रकार	ऑनलाईन ई-लिलाव				
लिलाव करण्यात येणाऱ्या	१. डॉ. सतिश शर्मा, २. डॉ. राजीव शर्मा, ३. आशा रविंद्र चांद, ४. रविंद्र रूपनारायण चांद, ५. रूपनारायण चांद (मयत) यांच्या द्वारे				
तारण मत्तेचे वर्णनः	गहाणीत अंबर बिल्डिंग येथे स्थित स्थावर मत्ता: फ्लॅट क्र. ४, ५, ६, १०, ११ आणि १२, १ला मजला, अंबर बिल्डिंग क्र. १, चार बंगला,				
	अंधेरी (प.), मुंबई-४०००५३ (सर्व फ्लॅट आतुन एकत्रित करुन एक युनिट सह एकूण चटई क्षेत्र १२५.४२ चौ.मीटर्स/बिल्ट अप १५०.५० चौ.				
	मीटर्स)				
	अनु. क्र.	युनिट	चटई क्षेत्र (चौ.मीटर्स)	बिल्ट अप क्षेत्र (चौ.मीटर्स)	
	8	फलॅट क. x	30.90	24.0/	

हुँ-लिलावाचे अटी आणि शर्ती: १. लिलाव विक्री ई-लिलाव माध्यमामार्फत आणि मदतीने सरफैसी ॲक्टच्या तरतुदीन्वये प्राधिकृत अधिकाऱ्यांद्वारे करण्यात येईल. लिलाव/बोली फक्त वेबसाईट <u>https://www.bankeauctions.com</u> ''ऑनलाईन इलेक्ट्रॉनिक माध्यम'' मार्फत करण्यात येईल. मे. सी१ इंडिया प्रायव्हेट लिमिटेड हे ई-लिलावाकरिता प्लॅटफॉर्मची यवस्था करण्यासाठी सेवा पुरवठादार आहेत २. लिलाव बोली दस्तावेजाच्या पुढील अटी आणि शर्तीनुसार आणि त्यातील नमूद प्रक्रियेनुसार करण्यात येईल. बोलीदार बोली दस्तावेज लिलावाकरिता ठेवलेल्या तारण मत्तेच्य

20.90

४१.८१

४१.८१

१२५.४२

24.06

40.90

940.40

फ्लॅट क्र. ५

फ्लॅट क्र. ६ आणि १२

फ्लॅट क्र. १० आणि ११

तपशिलाकरिता बोली प्रपत्र प्राप्त करण्याकरिता फिनिक्सची वेबसाईट <u>https://phoenixarc.co.in?p=2563</u> आणि सेवा पुरवठादारांची वेबसाईट <u>www.bankeauctions.com</u> बोलीदार त्यांच्या पसंतीने त्याचे स्वतःचे कार्यालय/ठिकाणावरून ई-लिलाव प्रस्ताव/बोलीमध्ये सहभागी होऊ शकतात. इंटरनेट कनेक्टिविटीची प्रत्येक बोलीदाराने तो स्वता/वं स्वतः व्यवस्था करावी. प्राधिकत अधिकारी/फिनिक्स/सेवा परवठादार हे इंटरनेट कनेक्टिविटी. नेटवर्क प्रॉब्लेम, सिस्टीम खराब होणे. विज जाणे इ.करिता जबाबदार राहणार नाहीत.

४. तपशील, मदत प्रक्रिया आणि लिलावावरील ऑनलाईन प्रशिक्षणाकरिता प्रस्तावित बोलीदार **श्री. हिए गोवडा मे. सी? इंडिया प्रायव्हेट लिमिटेड संपर्क क्रमांकः९१-१२४-**४३०२०२०/२०२१/२०२२/२०२३/२०२४, ९१–९५९४५९७५५५/०७२९१९८११२४/२५/२६, ईमेल आयडी : <u>support@bankeauctions.com</u> ५. ई-लिलाव येथील वरील नमूद तारीख आणि वेळी करता येईल ज्यावेळी ''जे आहे जेथे आहे'' तत्वाने आणि ''जे आहे जसे आहे'' अटीवर वरील नमूद मिळकत विकण्यात

६.. सर्व इच्छुक खरेदीदार/बोलीदारांनी <u>https://www.bankeauctions.com</u> अशा वरील नमृद पोर्टलमध्ये त्यांची नावे नोंदविणे आणि वरील सदर तारीख आणि वेळी ई-लिलावात सहभागी होण्यासाठी विनामुल्य युझर आयडी आणि पासवर्ड मिळविणे आवस्यक आहे. ७. ई-लिलावात सहभागी होण्यासाठी इच्छुक खरेदीदार/बोलीदारांनी वरील नमूद इ.अ.र. सादर करण्याच्या अंतिम तारखेपूर्वी पॅन कार्डची प्रत, कंपनीच्या बाबतीत मंडळाचा ठराव आ त्त्याच्या पराव्यासह तारण मत्तेच्या राखीव किंमतीच्या १०% परतावायोग्य इसारा अनामत रक्कम प्रदान केल्याचा तपशील <mark>१५.११.२०२२ (मंगळवार) रोजीस द</mark>. ४.३० रोजी किंवा

८. यशस्वी खोरीदार/बोलीदाराने १६.११.२०२२ (बुधवार) रोजीस १८.३० वा. किंवा पूर्वी म्हणजेच लिलावाच्या दिवशी किंवा बँकेची वेळ संपण्यापूर्वी पुढील कामकाजाच्य दिवसा अगोदर येथे वरील नमूद खाल्यामध्ये आरटीजीएस/एनईएफटीच्या मार्गाने त्याच्या/त्यांच्या प्रस्तावाच्या २५% (इ.अ.र. धरून) जमा करणे आणि फिनिक्सला कळविणे आवश्यक आहे. जी ठेव फिनिक्स निश्चित करेल कसूर केल्यास विक्री अयशस्वी झाल्याचे मानण्यात येईल आणि यशस्वी खरेदीदार/बोलीदाराची इ.अ.र. जप्त करण्यात येईल.

९. इतर सर्व बोलीदारांची इ.अ.र. जे ई-लिलावामध्ये यशस्वी होऊ शकलेले नाहीत त्यांना ई-लिलाव संपल्यानंतर ७२ तासात परत करण्यात येईल. इ.अ.र. वर व्याज देय नाही. १०. खरेदी मोबदल्याची उर्वरित रक्कम सदर तारण मत्तेची विक्री निश्चित केल्याच्या तारखेपासून पंधरा दिवसांत वा पूर्वी किंवा लेखी स्वरूपात कबूल केल्यानुसार वाढीव कालावधीत . यशस्वी खरेदीदार/बोलीदाराने जमा करणे आवश्यक आहे. कसूर केल्यास तोपर्यंत जमा केलेली सर्व रक्कम जप्त करण्यात येईल. ११. मिळकतीचे निरीक्षण आणि अधिक माहितीकरिता प्रस्तावित बोलीदार वरील नमूद पत्त्यावर श्री. अमित मासेकर यांना/श्री. अजित केविन, वर नमूद पत्ता किंवा amit.masekar@phoenixarc.co.in / ajit.kewin@phoenixarc.co.in / ईमेल किंवा ०९७६९४९७२८ / ०९६१९८६६७८० वर येथे संपर्क करू शकतात.

१२. इच्छुक बोलीदारांनी त्यांची बोली सादर करण्यापूर्वी लिलावासाठी ठेवलेल्या मिळकतीचे भार, नामाधिकार आणि सांविधिक थकबाकी इ. सह तारण मत्तेला बाधी दावे / हक्क / थकबाकीच्या संदर्भात स्वतंत्र चौकशी करणे आवश्यक आहे. १३. वर्तमानपत्रात प्रसिद्ध झालेल्या लिलावाच्या सूचनेत निर्दिष्ट केलेले तपशिल उत्तम माहितीकरीता अधोरेखित करुन सांगितले आहेत, तथापी कोणतीही तुटी, चुकीचा संदेश किंव

वगळले असल्यास त्याकरीता निम्नस्वाक्षरीकार जबाबदार राहणार नाही. १४. लिलावाच्या कोणत्याही समयी प्राधिकृत अधिकारी कोणतेही कारण न देता बोली/प्रस्ताव स्वीकारू/नाकारू/सुधारीत/रद किंवा कोणतीही पूर्व सूचना न देता आणि त्याचे कोणतेही कारण न देता ई-लिलाव पुढे ढकलू शकतात.

१५. वरील नियोजित लिलाव कोणत्याही कारणाने यशस्वी न होऊ शकल्यास फिनिक्स सरफैसी ॲक्ट, २००२ आणि सिक्युरिटी इंटरेस्ट (एन्फोर्समेंट) रुल्स २००२ च्या नियम ८(५) च्या तरतुदीन्वये कोणत्याही अन्य पद्धतीने तारण मत्तेची विक्री करण्याचा हक्क आहे. १६. यशस्वी खरेदीदार/बोलीदारांना कोणतीही सांविधिक थकबाकी, कर, देय शुल्क, मुद्रांक शुल्क, नोंदणी शुल्क इ. सोसावे लागेल जे प्रयोज्य कायद्यानुसार त्याच्या/तिच्य

१७. सर्व सांविधिक/अंसाविधिक थकबाकी, कर, दर, निर्धारित कर, भार, शुल्क, सोसायटीचे थिकत देखभार, वीज प्रभार, पाणी प्रभार इ. कोणाचेही देणे चुकने सर्वस्वी यशर्स्व

बोलीदारांची जबाबदारी असेल. १८. यशस्वी खरेदीदार/बोलीदार त्याच्या/त्यांच्या/तिच्या नांवे हस्तांतरित करण्याच्या प्रती पालिका प्राधिकरण/मंडळ/को-ऑपरेटीव्ह सोसायटी यांना देय असलेले कोणताह

खर्च/किंमत/भार/हस्तांतर अग्रित इ. करिता सर्वस्वी जबाबदार असेल. १९. कर्जदार/हमीदार/मालक/गहाणदार जे सदर थकबाकीकरिता जबाबदार आहेत त्यांनी सदर लिलाव सूचना ही वरील नमूद लिलाव विक्रीबाबत सिक्युरिटी इंटरेस्ट (एन्फोर्समेंट

ल्सच्या नियम ८(६) अन्वये सूचना समजावी.

प्राधिकृत अधिका फिनिक्स एआरसी प्रायव्हेट लिमिटेड, फिनिक्स ट्स्ट एफवाय १४–१३ स्किम र दिनांक: २१.१०.२०२२

PUBLIC NOTICE

For kind attention of the Shareholders/Creditors/Depositors of AGORA MICROFINANCE INDIA LIMITED (hereinafter referred to as "Company") having its Registered Office at Off No. 404, Wing-A, 4th Floor, Technocity premises Co-Op. Soc Ltd, Plot No. X-4/1 & X-4/2, Shillphata Mahape Nav Mumbai Thane MH 400709.

Notice is hereby given that pursuant to Circular No. DNBS (PD). CC. No. 344, 03.02.00112013-14 dated 01.07.2013 of Reserve Bank of India that, we Agora Microfinance NV, a Company duly incorporated under the laws of Netherlands and having Registered Office at Amsterdam, Netherlands and principal place of business at Atruim North Tower, 4th Floor, Strawinskylaan 4117, 1077 ZX Amsterdam, The Netherlands (hereinafter referred to as "Investor") agreed, to make a further round of investment of INR 8,00,00,000/- (Eight Crores Only) in the Company. The Company is a non-deposit taking public company under Section 45-IA of the Reserve Bank of India Act, 1934.

Upon completion of such further infusion of Funds into the Company by the Investors, the Company will allot the Equity Shares to the Investor at share price not less than mentioned in the Valuation Report. The aforementioned issuance of Equity shares by the Company shall not result in any change in control or management of the Company.

Any person including any Creditor or Depositor having any objection to the oposed equity infusion of the Company may write to the Company at Off N 404, Wing-A, 4th Floor, Technocity premises Co-Op. Soc Ltd, Plot No. X-4/1 & X-4/2, Shillphata Mahape Navi Mumbai Thane MH 400709. within 30 (Thirty) days from the date of publication of this Notice and also to the concerned Regional Office of the Department of Non-Banking Supervision Reserve Bank of India at Mumbai.

Date: 21/10/2022 Place: Navi Mumbai For 1) Agora Microfinance India Limited 2) Agora Microfinance NV



दत्तात्रय महाराज कळबे जावली सहकारी बँक लि.

(रजि. नं. BOM/BNK/127 of 1973) प्रशासकीय कार्यालय/ कर्ज वसुली विभाग ४१८/२०/२२, मौलाना आझाद रोड

मुंबई ४०० ००४ फोन नं. ०२२-२३८२२७७५/८६९१०९६१०७

जा.क्र.द.म.क./वसुली/वाशी/एएमटी/२७/२०२्२ नमुना - झेड

दिनांक १९.१०.२०२२

नियम १०७ चा उपनियम (११ (ड-१) स्थावर मालमत्तेकरीता ताबा सुचना

ज्या अर्थी खाली सही करणार हे द.म.क. जावली सहकारी बँक लि. चे महाराष्ट्र सहकारी संस्था नियम १९६१ अन्वये वसुली अधिकारी यांनी **१७.०१.२०२२** रोजी टेंम्पेटेंशन चायनिज कॉर्नर (प्रोप्रा श्री मुरलीधर मारुती चोरट) व्यवसाय कर्ज क्र. ७५१-३५६ रुपये २,३८,१३,०६५/- (रुपये दोन कोटी अडतीस लाख तेरा हजार पासष्ट फक्त) या कर्जाबाबत वसुली कार्यवाही संदर्भात महाराष्ट्र सहकारी संस्था नियम १९६१ चे नियम १०७(३) अन्वये नोटीसेस पारीत करुन नोटीसीतील कर्ज परत करण्यासाठी नोटीस मिळालेल्या तारखेनुसार कळविले होते व कर्जदारांनी सदर रक्कम परत करण्यास कसुर केली असल्यामुळे खाली सही करणार यांना ३१.०१.२०२२ रोजी जप्तीपूर्व नोटीस पाठवून खाली नमूद केलेली मालमत्ता जप्त

कर्जदाराने रक्कम परत फेड करण्यास कसुर केल्याने येथे सदर कर्जदार व जामीनदार श्री. सागर राजेश जाधव व जनतेला सुचना देण्यात येते की, खालील सही करणार यांनी खालील नमुद केलेल्या मालमत्तांचा प्रतिकात्मक ताबा कब्जा दि. २०.१०.२०२२ रोजी त्यांना महाराष्ट्र सहकारी संस्था नियम १९६१ चे नियम १०७ चा उपनियम (११(ड-१) नुसार असलेल्या अधिकारात घेतला आहे.

विशेषत: सदर कब्जेदारांना व इतर सर्व जनतेला येथे सावधगिरीची सुचना देण्यात येते की, सदर मालमत्ते संबंधी कोणतेही व्यवहार करु नयेत व सदर मालमत्तेसंबंधी कोणताही व्यवहार हा द.म.क. जावली सहकारी बँक लि. मुंबई यांचा दि. ३०.०९.२०२२ रोजीच्या व्याज व सरचार्जसह व्यवसाय कर्ज रुपये २,६४,०१,९७८/- (रुपये दोन कोटी चौसष्ट लाख एक हजार नवशे अठ्ठयाहत्तर फक्त) व त्यावरील पुढील व्याज व इतर चार्जेस रक्कमेच्या अधिन राहील.

स्थावर मालमत्तचे वर्णन/ तपशील

श्री मुरलीधर मारुती चोरट कर्जदार यांची मालकीची (गहाण खताने दिलेल स्थावर व्यवसाय मिळकत) पत्ता : वाशी रेल्वे किओस्क ओनर्स वेल्फेअर असोसिएशन किओस्क नं. २डी, फोरकोर्ट एरिया, वाशी रेल्वे स्टेशन कम कमर्शीअल कॉम्प्लेक्स, सेक्टर नं. ३०, वाशी, नवी मुंबई ४००७०३ एरिया १५.८७ स्वे मिटर

श्री सागर राजेश जाधव जामीनदार/ गहाणदार यांची मालकीची (गहाण खतान दिलेली स्थावर निवासी मिळकत) पत्ता : श्री ओमकर को ऑप हौसिंग सोसायटी लि, फ्लॅट नं. १०४, पहिला मजला, बिल्डिंग नं. १७-ई, घरोंदा नं.२, सेक्ट न. ९, घणसोली, नवी मुंबई ४००७०१. एरीया ५०४.७५० स्क्वे.फुट

वर नमूद केलेल्या व्यवसाय स्थावर मिळकती श्री मुरलीधर मारुती चोरट यांची व श्र सागर राजेश जाधव यांची निवासी मिळकत दुय्यम निबंधक जिल्हा–ठाणे यांचे कार्यकक्षेत आहे व नवी मुंबई महानगरपालिका हद्दीत आहे.

दिनांक : १९.१०.२०२२ ठिकाण : नवी मुंबई

(श्री अंकुश महादेव तुपे - वसुली अधिकारी) (महाराष्ट्र सह.संस्था अधिनियम १९६० व नियम १९६१ चे नियम १०७ अन्वये) शिक्क द्वारा द.म.क. जावली सहकारी बँक लि

PUBLIC NOTICE Notice is hereby given that, my clients **Mr. Rohar** Manjunath Uchil & Mrs. Vijayalakshmi Rohar Uchil are residents and lawful joint/co - owners of Flat No. 111, 1st Flr, Bhatia Building, Zarina CHSL 59-A, S.V. Road, Bandra West, Mumbai 40005 nereinafter referred to as the said Flat).. That the original Agreement Dated 6th May 1955 between Shri. Ishwardas Haridas Bhatia & Shri. Barjor Jamshedji Dastur in respect of the said Flat have peen lost/misplaced by them and they have made all efforts to trace the said documents, but the abovesaid Agreement is lost beyond recovery. Any erson/s having found the abovementioned original greement dated 6th May 1955 are requested to imate or inform the undersigned on the below entioned address and/or contact details within 15 days from the publication of this notice

Sd/- Shahzad Radhanpura - Advocate 21, Rajan Village Road, 1st FIr, Flat No.6, Off Carter Road, Bandra West, Mumbai - 400050. Email : advocateshahzad1@gmail.com Date : 21/10/2022 Mob : 9930468428 Date : 21/10/2022

जाहिर नोटीस

या नोटिसीद्वारे जाहिर कळविण्यात येते की माझे अशिल सौ. रिया रविंद्र कीरंजे, यानी सदनिका क्र. ओ - १, ५०१, शिव कोकण ऐक्य वर्धक एस. आर. ए. को. ऑ. ग्रह निर्माण संस्था मर्या., जानू भोये नगर, मालांड पुर्व, मुंबई नं. ४०० ०९७, क्षेत्रफळ - २६९ चौ. फुट, श्री. मेवालाल जगुन्नाथ विश्वकर्मा यांच्याकडून विकत घेण्याचे . टरविले आहे.

तरी सदर सदनिकेवर कोणाचाही कसलाही हक्क, हित संबंध, बोजा, गहाण, बेक्सिस, दान, कब्जा व इतर कसल्याही प्रकारचा हक्क असेल त्याने ही नोटीस प्रसिद्ध झाल्यापासून १५ दिवसांच्या आत खालील पत्यावर कागदेपत्रे व पुराव्यांसह लेखी हरकत नोंदवावी. मुदतीत हरकत आल्यास वरील सदनिकेसंबंधी कोणाचाही कोणताही हक्क. हितसंबंध नाही असे समजन माझे अशिल संदर सदनिकेचा खरेदी-विकी प्रवहार पुर्ण करतील. मुदतीनंतर आलेली हरकत वेचारात घेतली जाणार नाही

ॲंड. मोहन पी. गवस शॉप नं. 9३, अजंटा रकेअर मॉल, मार्केट लेन, बोरीवली कोर्टाजवळ, बोरीवली प. मुंबई - ४०० ०९२ Date: 21/10/2022 Place: Mumbai

1. Date

2. Name of the

दि सह्याद्रि सहकारी बॅक लि. , मुंबई मुख्य कार्यालय: ४४६, जे.एस.एस. रोड, चिरा वाझार, मुंवई-४०० ००२ दुर. क्र. (०२२)-२२०५ ४६४३/२२०१ ७४७७/२२०१ ६७७०

recovery@thesahyadribank.com / sahyadriho@rediffmail.com

नमुना झेड [नियम १**०**७ पोटनियम ११ (ड-१)]

स्थावर मालमत्तेकरीता ताबा सुचना

ज्या अर्थी खाली सही करणार हे दि सह्याद्रि सहकारी वॅक लि . , मुंबई चे महाराष्ट्र सहकारी संस्था, अधिनियम १९६० चे कलम १५६ आणि नियम १९६१ चे नियम १०७ अन्वये वसुली अधिकारी असून त्यांनी दि १२ /०९ /२०१६ रोजी कर्जवार १) मे . मेघवर्षा कंन्स्ट्रक्शन (पार्टनर श्री . प्रकाश मा . तिडके व मिलिंद प्र .तिडके), सहकर्जदार - गाडे वसंतराव आप्पासाहेब, जामीनदार - i) मे · मारूती ट्रेडिंग कॉर्पोरेशन (प्रोप्रा · शशिकला प्र ·तिडके), ii) तिडके साहेबराव मारूती, iii) मातेरे संजय लक्ष्मण -

२) मे . मारूती ट्रेडिंग कॉर्पोरेशन (प्रोप्रा . शशिकला प्र . तिडके) सहकर्जदार - गांडे वसंतराव आप्पासाहेब, जामीनदार, i) तिडके प्रकाश मारूती, ii) तिडके साहेबराव मारूती, iii) मातेरे संजय लक्ष्मण -

३) मे - मारूती वुडलॅंड मेकर्स प्रा - लि - (चेअरमन - प्रकाश मा - तिडके, संचालक i) तिडके साहेबराव मारूती, ii) शशिकला प्र - तिडके, iii) तिडके वनिता साहेबराव), जामीनदार - i) तिडके मिलिंद प्रकाश, ii) तिडके अभिजीत

या कर्जदारांस मागणी (डिमांड) नोटीस पारीत करून नोटीसीमध्ये नमूद केलेली एकत्रित रक्कम **रू.८,४७,९७,५७६/-(अक्षरी ३ ऑठ कोटि सत्तेचाळीस लाख सत्यांणव हजार पाचशे शहात्तर फक्त**) सदर नोटीस मिळाल्याच्या दिनांकापासून आणि कर्जदार यांने रक्कम जमा करण्यास कसूर केली आहे, वसुली अधिकारी यांना प्राप्त अधिकारानुसार दि .१२/०९/२०२२ रोजी जप्तीची नोटीस दिली असून, पुढे निर्दिष्ट केलेली मालमत्ता जप्त करण्यात आली आहे .

कर्जदारांनी रक्कम परतफेड करण्यास कसर केल्याने येथे सदर कर्जदार व जामीनदारांस याप्रमाणे नोटीस देण्यात येत आहे व सर्व नागरिकांना व्वाली निर्दिष्ट केलेल्या मालमनेता व्वाली सही करणाऱ्याने त्याला महाराष्ट्र सहकारी संस्था नियम, १९६१ चे नियम १**०**७ पोटनियम ११ (ड–१) अन्वये दिलेल्या अधिकारानुसार १५ /१०/२**०**२२ या दिवशी प्रतिकात्मक तावा घेतला आहे.

विशेषत: सदर कर्जदाराला व इतर सर्व जनतेला येथे सावधगिरीची सूचना देण्यात येते की, सदर मालमत्तेसंबंधी कोणतेही व्यवहार करू नयेत व सदर मालमत्तेसंवंधी कोणताही व्यवहार हा दि सह्याद्रि सहकारी वॅक लि . , मुंबई यांचा वोजा दि \cdot ३०/०९/२०२२ अखेर **रू\cdot१९,५२,६३,३८७/–(रूपये एकोणवीस कोटि बावण्ण लाख त्रेसेष्ठ हजार तीनशे सत्याऐंशी फक्त)** व त्यावरील व्याज रक्कमेच्या अधीन राही

स्थावर मालमत्तेचे वर्णन / तपशिल

श्री . प्रकाश मारूती तिडके यांची वैयक्तिक मालकी असलेली वंधारपाडा, सजा कोशिंवे, ता . दिंडोरी, जि . नाशिक . येथील गट नं .३८ (क्षेत्रफळ १ व हे .८३ आर) , गट नं .४० (क्षेत्रफळ १६ हे .१७ आर)

दिनांक : १५ .१० .२०२२ ठिकाण : वंधारपाडा, ता . दिंडोरी, जि . नाशिक .

सही /-(महादेव वापुराव खोपडे) वसुली अधिकारी महाराष्ट्र सहकारी संस्था, अधिनियम १९६० चे कलम १५६ आणि नियम १९६१ चे नियम १०७ अन्वये

INEOS **STYROLUTION**

Driving Success. Together.

INEOS STYROLUTION INDIA LIMITED

CIN: L25200GJ1973PLC002436

October 20, 2022

INFOS Styrolution India Limited

Regd. Office: 5th Floor, OHM House - II, OHM Business Park, Subhanpura, Vadodara - 390 023. **Tel. No.**: +91 265 2303201 / 2303202

E mail: lNSTY.secshare@ineos.com Website: www.ineosstyrolutionindia.com

Recommendations of the Committee of Independent Directors (IDC) of INEOS Styrolution India Limited ("Target Company") on the Open Offer (hereinafter defined) made by Shiva Performance Materials Private Limited ("Acquirer") together with Geetganga Investment Private Limited ("PAC 1"), Mr. Rakesh Agrawal ("PAC 2") and Mr. Rahul Agrawal ("PAC 3") (PAC 1, PAC 2 and PAC 3 collectively to be referred as "PACs"), in their capacity as the persons acting in concert with the Acquirer, to the public shareholders of the Target Company, under Regulation 26(7) of the Securities and Exchange Board of India (Substantial Acquisition of Shares and Takeovers) Regulations, 2011 and subsequent amendments thereto ("SEBI (SAST) Regulations").

2.	Name of the Target Company (TC)	INEOS Styrolution India Limited
3.	Details of the Offer pertaining to TC	Open offer for acquisition of up to 45,72,263 fully paid-up equity shares of face value of INR 10 each ("Equity Shares") from the Public Shareholders of the Target Company, representing 26,00% of the Voting Share Capital of the Target Company on a fully diluted basis as on the 10th working day from the closure of tendering period, at a price of INR 848.72 per Equity Share (the "Offer Price") aggregating to total consideration of up to INR 388,05,71,054 (assuming full acceptance) payable in cash. The public announcement dated August 1, 2022 ("PA"), the detailed public statement published on August 5, 2022 ("DPS"), the draft letter of offer dated August 10, 2022 ("DLOF"), and the letter of offer dated October 17, 2022 ("LOF") have been issued by JM Financial Limited on behalf of the Acquirer and the PACs.
4.	Name(s) of the acquirer and PAC	Acquirer: Shiva Performance Materials Private Limited PACs: Geetganga Investment Private Limited (PAC 1) Mr. Rakesh Agrawal (PAC 2); and Mr. Rahul Agrawal (PAC 3).
5.	Name of the Manager to the offer	JM Financial Limited 7th Floor, Cnergy, Appasaheb Marathe Marg, Prabhadevi, Mumbai - 400 025. Tel: + 91 22 6630 3030 Fax: + 91 22 6630 3330 Contact person: Ms. Prachee Dhuri Email: ineos.openoffer@jmfl.com SEBI registration no.: INM000010361
6.	Members of the Committee of Independent Directors (Please indicate the chairperson of the Committee separately)	Mr. Vinesh Sadekar (Chairperson) Ms. Sandra Martyres (Member)
7.	IDC Member's relationship with the TC (Director, Equity shares owned, any other contract/relationship), if any	The members of the IDC are independent directors on the board of directors of the Target Company. None of the members of the IDC hold any Equity Shares/securities of the Target Company. Except as mentioned below, none of the members of the IDC have entered into any contract or have any relationship with the Target Company: a. Mr. Vinesh Sadekar is the chairperson of the Audit Committee, the Nomination and Remuneration Committee and Risk Management Committee of the Target Company, and is a member of the Corporate Social Responsibility Committee of the Target Company; and b. Ms. Sandra Martyres is the chairperson of the Stakeholders Relationship and Grievance Committee and the Corporate Social Responsibility Committee of the Target Company, and is a member of the Audit Committee and the Nomination & Remuneration Committee of the Target Company.
8.	Trading in the Equity shares / other securities of the TC by IDC Members	None of the members of the IDC have traded in any of the Equity Shares / securities of the Target Company during the: a. 12 months period preceding the date of the PA; and b. period from the date of the PA and till the date of this recommendation.
9.	IDC Member's relationship with the acquirer (Director, Equity shares owned, any other contract / relationship), if any.	None of the members of IDC: a. are directors on the boards of the Acquirer or the PACs; b. hold any equity shares or other securities of the Acquirer or the PACs; and c. have any contracts/ relationship with the Acquirer or the PACs.
10.	Trading in the Equity shares / other securities of the acquirer by IDC Members	None of the members of the IDC have traded in any of the equity shares/ securities of the Acquirer or the PACs during the: a. 12 months period preceding the date of the PA; and b. period from the date of the PA and till the date of this recommendation.
11.	Recommendation on the Open offer, as to whether the offer is fair and reasonable	The IDC is of the opinion that the Offer Price of Rs. 848.72 (Indian Rupees Eight hundred forty-eight and paise seventy two only) per Equity Share offered by the Acquirer is (a) in accordance with the applicable regulations under the SEBI (SAST) Regulations, and (b) accordingly, the Open Offer appears to be fair and reasonable. However, IDC would like to point out that the share price of the company is dynamic in nature and is subject to daily fluctuations and change. The closing share price (as at the end of day October 19, 2022) of the Target Company on the NSE was INR 839.40. The shareholders are advised to independently evaluate the open offer and take an informed decision, whether or not to tender their equity shares in the open offer.
12.	Summary of reasons for recommendation	The IDC has reviewed the PA, the DPS, and the LOF. Further, Shailesh Haribhakti& Associates, Chartered Accountants, appointed by the IDC to provide its independent opinion, has confirmed that the Offer Price of Rs.

high**l**ighted To the best of our knowledge and belief, after making proper enquiry, the information contained in or accompanying this statement is, in all material respects, true and correct and not misleading, whether by omission of any information or otherwise, and includes all the information required to be disclosed by the Target Company under the SEBI (SAST Regulations.

provide its independent opinion with respect to the Offer Price

13. Details of voting pattern

Advisors, if any.

14.

15.

Place: Mumbai

Date: October 20, 2022

Details of Independent

Any other matter(s) to be None

For and on behalf of the Committee of the Independent Directors of INEOS Styrolution India Limited

848.72 (Indian Rupees Eight hundred forty-eight and paise seventy two only) per

Equity Share is in accordance with the Regulation 8(2) of the SEBI (SAST

Regulations and opined that the Offer Price of 848,72 (Indian Rupees Eight hundre

In view of the above, the IDC has set out its recommendation in paragraph 11 above.

This statement of recommendation will also be available on the website of the Targe

https://www.ineosstyrolutionindia.com/INTERSHOP/web/WFS/Styrolution-India

Site/en_US/-/USD/ViewContent-Start?PageletEntryPointID=investors-investors

Shailesh Haribhakti & Associates, Chartered Accountants, appointed by the IDC to

The recommendation was unanimously approved by the members of the IDC

forty eight and paise seventy two only) per Equity Share is fair and reasonable.

Vinesh Sadekar

Chairperson - Committee of Independent Directors DIN: 00046815

ડિફેન્સ એક્સુપો - ૨૦૨૨ અંતર્ગત

महात्मा मंहिर जाते वैश्विड QA પ્રેક્ટિસ વિષય પર પરિસંવાદ યોજાયો

(પ્રતિનિધિ)અમદાવાદ,તા.૨૦ સ્વદેશી સંરક્ષણ સાધનોનું વિશ્વ કક્ષાએ વેચાણ કરવા માટે તેની ગુણવત્તા સાથે વિશ્વસનીયતા હોવી ખૂબ જરૂરી છે, તેવું આજરોજ ડિફેન્સ એક્સ્પો- ૨૦૨૨ અંતર્ગત મહાત્મા મંદિર ખાતે યોજાયેલ 'વૈશ્વિક QA પ્રેકિટસ' વિષય પર યોજાયેલ પરિસંવાદમાં સંરક્ષણ રાજ્ય મંત્રી અજય ભટ્ટે જણાવ્યું હતું

વસુદેવ કુટુંબની ભાવના આપણી સંસ્કૃતિ છે, સંરક્ષણ સાધનો માત્ર આપણા માટે જ નહીં, પરંત્ આપણા પાડોશી દેશોને પણ ઉપયોગી થઈ શકે તેવા વિશ્વસ્તરીય ગુણવત્તાવાળા સરક્ષણ સાધનોનું ઉત્પાદન કરવું ખૂબ જરૂરી છે. આપણે આ દિશામાં અગ્રેસર છીએ, રક્ષા મંત્રાલય દ્વારા ડિફેન્સ સાધનોના ઉત્પાદન માટે અનેક નીતિ બનાવી છે.

તેમજ ઉત્પાદનની ગુણવત્તા માટે કંપનીને જવાબદાર કરી રહ્યા છીએ. તેની સાથે ગુણવત્તાવાળા સંરક્ષણ સાધનોના પરીક્ષણ માટે દેશમાં આઠ સ્થળોએ રક્ષા પરીક્ષણ કેન્દ્રો બનાવવામાં આવ્યા છે. લખનઉ ખાતેના રક્ષા પરીક્ષણ કેન્દ્ર વિકસાવવામાં આવ્યું છે. તેમ જ આ ેકેન્દ્ર ખાતે ડિફેન્સ સાધનોની ગુણવત્તા અને અન્ય અભ્યાસ કરવા માટેની સ્વિધાઓ પણ આગામી સમયમાં ઉભી કરવામાં આવશેતેમણે જણાવ્યું હતું કે સીપરી નામની વૈશ્વિક સંસ્થા જે વિશ્વ કક્ષાએ લશ્કરનો સર્વે કરી તેનો રિપોર્ટ બહાર પાડે છે. જે સંસ્થા દ્વારા વિશ્વના ૨૫ દેશોમાં ભારતનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ રિપોર્ટમાં પ્રથમ વાર ભારત દેશનું નામ આવ્યું છે, તેની પાછળનું મુખ્ય કારણ સંરક્ષણ સાધનોમાં આપણી ગુણવત્તા અને

વિશ્વસનીયતા છે. જો ગુણવત્તા અને વિશ્વસનીયતા નબળી હોત તો આપણે વિશ્વના ૨૫ અગ્રેસર દેશોમાં આપણા નામનો સમાવેશ થતો ન હોત.

તેમણે ઉમેર્યુ હતું કે સ્વદેશી સંરક્ષણ સાધનોના વ્યવસાયને પ્રોત્સાહન આપવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ બજેટમાં ૬૮% સંરક્ષણ સાધનોની ખરીદી સ્વદેશી ઉત્પાદનોની કરવા માટે નક્કી કરવામાં આવ્યું છે. જેના થકી અનેક સંરક્ષણ સાધનો બનાવતી સ્વદેશી નાની મોટી કંપનીઓને પ્રોત્સાહન મળી રહ્યું છે. વર્ષ ૨૦૨૧ - ૨૨ માં રક્ષામંત્રાલય નું બજેટ ૧૩ હજાર કરોડ રૂપિયા હતું આગામી ૨૦૨૫ સુધીમાં

આ બજેટ ૩૫ હજાર કરોડ સુધી પહોંચાડવાનું લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. આ તહેવારોની મોસમમાં ભારત એમેઝોન પર ખરીદી કરે છે; સેંકડો નાના અને સ્થાનિક વિક્રેતાઓ કરોડપતિ બન્યા

એમેઝોને આજે જાહેરાત કરી છે કે તેના મહિના-લાંબા ગ્રેટ ઈન્ડિયન ફેસ્ટિવલ ૨૦૨૨માં Amazon.in પર તેના વિક્રેતાઓ અને બ્રાનુડ ભાગીદારો માટે અત્યાર સુધીની સૌથી મોટી શોપિંગ ઉજવણી જોવા મળી છે, જે દેશભરના લાખો ગ્રાહકોને આનંદ આપે છે. GIF2022 ૨૨મી સપ્ટેમ્બરની મધ્યરાત્રિએ પ્રાઇમ અહીં એક્સેસ સાથે શરૂ થયો અને ૨૩ સપ્ટે.ના રોજ તમામ ગ્રાહકો માટે લાઇવ થયો. ગ્રાહકોને Amazon.in પર વિક્રેતાઓ તરફથી કરોડો પ્રોડક્ટની પસંદગી પસંદ આવી, જેમાં લાખો નાના અને મધ્યમ વ્યવસાયો ના અનન્ય ઉત્પાદનોનો સમાવેશ થાય છે. અમે આ તહેવારોની સિઝનમાં ગ્રાહકોને સેવા આપવા અને સમગ્ર ભારતમાં વેચાણકર્તાઓને સક્ષમ કરવા માટે અત્યંત નમ્ર છીએ. નાના અને મધ્યમ ઉદ્યોગો, સ્ટાર્ટઅપ્સ, કારીગરો અને મહિલા સાહસિકોએ સમગ્ર ભારતમાં અમારા ગ્રાહકોને ઉત્પાદનોની વિશાળ પસંદગી ઓફર કરી હતી. ખાસ કરીને ટિયર

૨-૩ શહેરોમાંથી આ કેસ્ટિવ સીઝનમાં નવા પ્રાઇમ મેમ્બર સાઇન-અપમાં વધારો થવાથી અમને આનંદ થયો છે અને ગ્રાહકો તેમના પસંદગીના ઓનલાઈન શોપિંગ ડેસ્ટિનેશન તરીકે એમેઝોન પર તેમનો વિશ્વાસ વધુ મજબૂત કરવાનું ચાલુ રાખે છે. આ વર્ષે એમેઝોન ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવલ માટે અમારા ગ્રાહકોએ 'એમેઝોન સે લિયા'નો પડઘો પાડચો, એમેઝોન ઇન્ડિયાના કન્ટ્રી મેનેજર મનીષ તિવારીએ જણાવ્યું. overall સ્કેલ, પહોંચ અને ગ્રાહક પ્રતિસાદ ભારતે Amazon.in પર ૯૯.૬% સેવાયોગ્ય પિન કોડ પર પેકેજ વિતરિત કરીને સુરક્ષિત રીતે ખરીદી કરી; લદ્દાખ પ્રદેશમાં સુસ્પોલ ગામ સૌથી દુર છે ગ્રાહકોએ એમેઝોન ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવલનો અનુભવ અંગ્રેજી, હિન્દી, તમિલ, તેલુગુ, મલયાલમ, કન્નડ, બાંગ્લા અને મરાઠીમાં કર્યો અને સાથે હિન્દી અને અંગ્રેજીમાં વોઇસ શોપિંગ કર્યું પ્રાઇમ ગ્રાહકોને રોમાંચિત કરવાનું ચાલુ રાખે છે ૨૦૨૧ વિરુદ્ધ 1.2x વધુ પ્રાઇમ મેમ્બર સાઇન અપ કરે છે;

અગરતલા. બેલારી, કટક, વારંગલ. જલગાંવ અને ભીલવાડા સહિતના ટિયર ૨-૩ નગરો/શહેરોમાંથી આવતા પમાંથી ૩ સાઇનઅપ પ્રથમ ૩૬ કલાકમાં પ્રાઇમ સાઇન અપનો સૌથી વધુ સિંગલ ડે

તહેવારોની સિઝનમાં ખરીદી કરનારા રમાંથી ૧ પ્રાઇમ મેમ્બર ટાયર ૨ અને ૩ નગરમાંથી છે. ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવલ 'સેલર-બ્રેશન્સ' ૩૫,૦૦૦ થી વધ્ વિક્રેતાઓએ તેમનું અત્યાર સુધીનું સૌથી વધુ સિંગલ-ડે વેચાણ જોયું; કપે ગથી વધુ વિક્રેતાઓ કરોડપતિ અને ૨૩,૦૦૦ વિક્રેતાઓ લાખપતિ બન્ય. સમગ્ર ભારતમાં ૭૦% થી વધુ વેચાણકર્તાઓ ટાયર ૨-૩ નગરો અને શહેરોમાંથી આવ્યા હતા ૪,૦૦૦ થી વધુ વિક્રેતાઓએ પડ અને તેથી વધુની વેચાણ વૃદ્ધિ જોઈ; અમારા વિક્રેતાઓ દ્વારા દર સેકન્ડે ૨૫ ઉત્પાદનોનું વેચાણ કરવામાં આવ્યું હતું જેમાં ઘર, વસ્ત્રો, સૌંદર્ય અને રસોડું કેટેગરી

ટાટા એઆઇએએ ભારતીય ઉપભોકતાઓને આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રસિદ્ધ સર્વાંગી સુખાકારી પ્રોગ્રામ વાઇટાલિટી પ્રસ્ત્ત કર્યો

🦱 ભારતમાં અગ્રણી જીવન વીમાકંપની ટાટા એઆઇએ લાઇક ઇન્સ્યોરન્સ એ વિશિષ્ટ વેલનેસ પ્રોગ્રામ -ટાટા એઆઇએ વાઇટાલિટી- પ્રસ્તુત કરવાની સાથે એના જીવન વીમા સોલ્યુશન્સની રેન્જ વધારી છે. ટાટા એઆઇએ વાઇટાલિટી એના રાઇડર પેકેજીસ, વાઇટાલિટી પ્રોટેક્ટ અને વાઇટાલિટી હેલ્થ દ્વારા ઉપલબ્ધ છે. આ સાથે ટાટા એઆઇએએ ભારતમાં ઉપભોક્તાઓ માટે આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રસિદ્ધ વાઇટાલિટી પ્લેટફોર્મ પ્રસૃતૃત કર્યું છે, જે ૪૦ દેશોમાં ઉપલબ્ધ છે અને છેલાં ૨૫ વર્ષમાં ૩૦ મિલિયન વ્યક્તિઓને માટે લાભદાયક રહ્યું છે. ઉપયોગ-કરવામાં-સરળ મોબાઇલ એપ દ્વારા સુલભ ટાટા એઆઇએના પોલિસીધારકો એનો ઉપયોગ હેલ્થ ચેક-અપ્સનો લાભ લેવા અને વેલનેસ પ્રવૃત્તિઓ અપનાવવા કરી શકે છે, જેથી તેમને સ્વસ્થ જીવનશૈલીમાંથી લાભ પ્રાપ્ત થયા છે. આ ઉપરાંત ઉપભોક્તાઓને આગોતરું ડિસ્કાઉન્ટ અને તેમના પ્રીમિયમ રિન્યૂઅલ પર લાભ મળે છે. ટાટા એઆઇએ વાઇટાલિટી વેલનેસ પ્રોગ્રામ ડેટા સંચાલિત એનાલીટિકલ ટ્રલ્સનો ઉપયોગ કરે છે, જેથી ઉપભોક્તાઓને સર્વાંગી સુખાકારી માટે આવશ્યક પગલાં લેવામાં મદદ મળે છે. ઉપભોક્તાઓ ટાટા

એ આઇએની ટર્મ, સેવિંગ અને ગ્રાહકકેનિદ્રત સોલ્યુશનની પ્રસ્તૃતતા સુનિસ્થિત કરીએ છીએ. વાઇટાલિટીની

ટી.ઓ.ડી.

૩૧-ઓક્ટો-૨૨

૦૨-નવે-૨૨

૦૩-નવે-૨૨

૦૭-નવે-૨૨

૦૮-નવે-૨૨

૦૮-નવે-૨૨

૦૯-નવે-૨૨

૪૦૦ સેટ

८००५२००

૫૫ નંગ

૨૮૦૩૦ નંગ

૧૨૫ નંગ

ર૯૮નંગ

૧૨૬૬નંગ

૨૪૦૮૦નંગ

૨૦ સેટ

મુખ્ય ચીફ મટીરીયલ્સ મેનેજર વતી

ર૩૨૧૭૬ મીટર વવ-નવે-૨૨

૧૨૧૪૯૬ કમ ૧૭-નવે-૨૨

પશ્ચિમ રેલ્વે

ઇ-પ્રોક્યોરમેન્ટ ટેન્ડર નોટિસ નંબર એસ/૩૩/૨૦૨૨

તારીખ ૨૦.૧૦.૨૦૨૨

૫૨૯ સ્વિંગ ડોર ૪૦૦ સેટની સંપૂર્ણ એસેમ્બલી

૫૩૨ K પ્રકાર નોન એસ્બેસ્ટોસ કોમ્પોઝિટ બ્રેક બ્લોક

પાઉ દ કેસનબ બોગીઝ માટે સંશોધિત એલાડટોમેરિક પેડ

૫૪૦ લેધર ડક્ટ એર બેલો એસેમ્બલી- ટ્રેક્શન મોટર એર

ડક્ટ થી DLW pt નંબર ૧૭૪૫૨૨૬૦ માટે ફ્લેક્સિબલ

વેગતવાર સૂચના ઇએમડી, ખરીદી પ્રતિબંધો અને વિગતવાર ટેન્ડર શરતો અંગે, કૃપા કરીને

બસાઇટ www.ireps.gov.in અને www.wr.indianrailways.gov.in ની મુલાકાત લો

લાઇક કરો: 🗲 facebook.comNVesternRly ફોલો કરો 📝 twitter:com/Wes

૫૩૭ W.W.Govern માટે ૬ વાર્ષિક મેન્ટેનન્સ કિટ

એલોય સિરોલિમસ તમામ કદ સાથે

૫૩૫ બાઉન્ડેડ રબર સેન્ડવિચ માઉન્ટિંગ

૫૩૯ ઔદ્યોગિક સંકુચિત ઓક્સિજન ગેસ

૧૨ ઇંચ / A-૪ કદ

૫૩૧ ફ્લેક્સ બોલ કેબલ

૫૩૪ સ્પીડ સેન્સર માટે કીટ

૫૩૮ મેન્યુઅલ મેટલ આર્ક.

પ30 T પર૪ F, રિઝર્વેશન ફોર્મ માટે અરજી, કદ-૮.૫ X

૫૩૩ ડ્રગ એલ્યુટીંગ કોરોનરી સ્ટેન્ટ સિસ્ટમ-કોળાલ્ટ ક્રોમિયમ

રિટાયર્મેન્ટમાં વીમાયોજનાઓ સાથે ઉપલબ્ધ રાઇડર્સ ખરીદીને આ સર્વાંગી વેલનેસ પ્લેટફોર્મનો લાભ લઈ શકે છે. બેઝ વીમાપોલિસીની સાથે વધારાના પ્રીમિયમ સ્વરૂપે નાની રકમની ચુકવણી કરીને ઉપભોક્તાઓ રાઇડર્સ મેળવીને કિંમતી લાભો મેળવે છે. વાઇટાલિટી પ્રોટેક્ટ રાઇડર ઉપભોક્તાઓને તેમનું ટર્મ વીમાકવચ વધારવાના વિકલ્પ ઉપરાંત અકસ્માતમાં મૃત્યુ, અકસ્માતમાં સંપૂર્ણ અને કાયમી વિકલાંગતા જેવા બનાવો સામે વિસ્તૃત વીમાકવચ પ્રદાન કરે છે. વાઇટાલિટી હેલ્થ રાઇડર લાંબા ગાળાની ગંભીર બિમારી સામે વીમાકવચ અને કોઈ પણ સારવાર માટે હોસ્પિટલમાં સારવાર લેનાર વીમાધારકને દરરોજ કેશ જેવા ફાયદા આપે છે. આ પ્રસંગે ટાટા એઆઇએ લાઇફ ઇન્સ્યોરન્સના પ્રેસિડન્ટ અને ચીક ડિસ્ટ્રિબ્યુશન ઓફિસર વેંકી ઐયરે કહ્યું હતું કે, ટાટા એઆઇએમાં અમે ઉપભોક્તા સાથે લગાવના અમારા મૂલ્ય દ્વારા સંચાલિત છીએ. અમે ઉપભોક્તાઓની બદલાતી જરૂરિયાતોને સુસંગત રીતે સતત પરિવર્તન કરીએ છીએ તથા નવીન અને

થવા પર ગર્વ છે.

પ્રસ્તુતતા પેયરમાંથી પાર્ટનર બનવાનાં અમારા પરિવર્તનમાં મહત્વપૂર્ણ પગલું છે. આ જાહેરાત પર વાઇટાલિટી ગ્લોબલના સીઇઓ બેરી સ્વાર્ત્ઝબર્ગે કહ્યું હતું કે, અમને વાઇટાલિટી પ્રોગ્રામની પહોંચ વધારવા અને લાખો લોકોને સ્વસ્થ બનાવવાની એની ક્ષમતા વધારવા ટાટા એઆઇએ સાથે જોડાણ કરવા પર બહુ ગર્વ છે. અમારા માટે આ મહત્વપૂર્ણ સીમાચિદ્ધ છે, કારણ કે વીમા માટે વાઇટાલિટી સાથે સંબંધિત દેશોની યાદીમાં ભારતનો સમાવેશ અમારા માટે દુનિયાભરમાં ૪૦મું બજાર છે. આ પહેલ પર ટાટા એઆઇએના બ્રાન્ડ એમ્બેસેડર નીરજ ચોપરાએ કહ્યું હતું કે, સ્વસ્થ અને ચપળ હોવાનું મહત્વ પર્યાપ્ત ન હોય એવું બની શકે છે. સ્વસ્થ હોવું એ ફિઝિકલ ફિટનેસ કરતાં વિશેષ બાબત છે અને તેમાં માનસિક, ન્યૂદ્રિશનલ અને સામાજિક ફિટનેસ સહિત તમામ પાસાં સામેલ કરવાની જરૂર છે. મને ભારતમાં ટાટા એઆઇએ વાઇટાલિટી શરૂ કરવામાં સામેલ

સિટી પોલીસ સ્ટેશન માં કરી હતી. જેથી સિટી પોલીસના પોલીસ ઇન્સ્પેકટર દ્ધ.દ્ર લાઠીયા દ્વારા સમગ્ર મામલાની ઝીણવટ ભરી તપાસ હાથ ધરતાં કેટલાક ચોંકાવનારા ખુલાસા સામે આવ્યા હતા.પોલીસ તપાસમાં વેપારીના આપધાત પાછળ પ્રેમ પ્રકરણમાં થતું બ્લેકમેઇલિંગ સામે આવ્યું હતું. જેથી જ સિટી પોલીસ દ્વારા વેપારી ને આપધાત માટે મજબૂર કરનાર પ્રેમિકા સલમા મલેકના પતિ દરવેશ મલેકની ધરપકડ કરવામાં આવી હતી અને ઉઠક બેઠક કરાવી કાયદાના પાઠ ભણાવવામાં આવ્યા હતા.મહત્વનું છે કે, દરવેશ મલેક ઉજાગર થઈ છે.

જેએમ ફાઇનાન્સિયલ હોમ લોન્સ લિ.

JM FINANCIAL

જીસ્ટર ઓફિસઃ ૭મો માળ, સીનર્જી, અપ્પાસાહેબ મરાઠે માર્ગ, પ્રભાદેવી, લિ. મુંબઈ ૪૦૦ ૦૨૫. HOME LOANS

કબજાની સૂચના (સુરક્ષા હિત (એન્ફોર્સમેન્ટ) નિયમો, ૨૦૦૨ ના નિયમ ૮ (૧) હેઠળ)

_{જ્}યારે જેએમ ફાઇનાન્શિયલ હોમ લોન લિમિટેડના અધિકૃત અધિકારી તરીકે નીચે સહી કરેલ છે, જેની ૭મા માળે નોંધાયેલ ઓફિસ છે, સીનર્જી,અપ્પાસાહેબ મરાઠે માર્ગ, પ્રભાદેવી, મુંબઈ - ૪૦૦૦૨૫, સિક્યોરિટાઈઝેશન એન્ડ રિકન્સ્ટ્રક્શન ઓફ ફાઈનાન્શિયલ એસેટ્સ એન્ડ એન્ફોર્સમેન્ટ ઓફ સિક્યોરિટી ઈન્ટરેસ્ટ એક્ટ, ૨૦૦૨ (૨૦૦૨ નું ૫૪) હેઠળ અને નિયમ ૩ ના કલમ ૧૩ (૧૨) હેઠળ આપવામાં આવેલી સત્તાના ઉપયોગ માટે સિક્યોરિટી ઈન્ટરેસ્ટ (એન્ફોર્સમેન્ટ) ફ્રસ્સ, ૨૦૦૨ એ અહીં ઉક્ષેખિત તારીખની ડિમાન્ડ નોટિસ જારી કરી છે, જેમાં નીચેના ત્રણ લેનારાઓને નોટિસમાં ઉક્ષેખિત રકમની ચુકવણી કરવા માટે આહ્વાન કરવામાં આવ્યું છે, જે નોટિસ પ્રાપ્ત થયાની તારીખથી ૬૦ દિવસની અંદર અહીં ઉક્ષેખિત છે. નીચેના ઋણ લેનારાઓ સ્કમ ચૂકવવામાં નિષ્કળ ગયા છે, આથી નીચેના ઋશ લેનારાઓને અને સામાન્ય રીતે જાહેર જનતાને નોટિસ આપવામાં આવે છે કે જેમણે કલમ ૧૩ ની પેટા કલમ (૪) હેઠળ તેમને આપવામાં આવેલી સત્તાનો ઉપયોગ કરીને અહીં નીચે વર્ણવેલ મિલકતોનો કબજો મેળવ્યો છે. અધિનિયમના સિક્યોરિટી ઈન્ટરેસ્ટ (એન્ફોર્સમેન્ટ) નિયમો,

ઋગ લેનાર/સહ-ઉધાર લેનારાઓ/ જામીનદારોનું નામ અને લોન એકાઉન્ટ નંબર	ડિમાન્ડ નોટિસ અને બાકીની તારીખ	સત્તાવર મિલકતનું વર્જાન	ક બ્જાની તારીખ
પ્રણવ યુ નેન્સોનિયા રીપલ પક્ષવ નેન્સોનિયા વિશા પ્રણવ નેન્સોનિયા પક્ષવ ઉપેન્દ્રભાઈ નેસોનૈયા મેસર્સ પી યુ નેન્સોનૈયા અને કો HRJT૨૧૦૦૦૦૧૫૮૯૩	રૂ. ૧,૩૭,૪૩,૩૫૩/- (રૂપિયા એક કરોડ તેત્રીસ લાખ ત્રેતાલીસ હજાર ત્રણસો ત્રેપન માત્ર)	સર્વે નંબર ૪૧૦, નવો સર્વે નંબર ૫૪૦ અને ૫૪૧, ખાતા નંબર ૮૬૬, ટીપી સ્કીમ નંબર ૧, એકપી નંબર ૫૬ ડુપ્લેક્સ નંબર ૧૫ અને ૧૩, અશોક વાટિકા બિલ ગામ, બીએચ શિલ્ચર કંપની, વડોદરા, ગુજરાત – ૩૯૧૪૧૦. સર્વે નંબર ૪૧૦, જૂનો સર્વે નંબર ૫૪૦ અને ૫૪૧, ખાતા નંબર ૮૬૬, ટીપી સ્કીમ નંબર ૧, એફપી નંબર ૫૬, ડ્યેક્સ નંબર ૧૩ અને ૧૫, અશોક વાટિકા બિલ ગામ, બીએચ શિલ્ચર કંપની, વડોદરા, ગુજરાત – ૩૯૧૪૧૦	

માસ કરીને ઉધાર લેનારને અને સામાન્ય રીતે જનતાને આથી સાવચેતી આપવામાં આવે છે કે મિલકત સાથે કોઈ વ્યવહાર ન કરે અને મિલકત સાથેનો કોઈપણ વ્યવહાર જેએમ ફાયનાન્સિયલ હોમ લોન લિમિટેડના ચાર્જને આધીન રહેશે ઉપરોક્ત ઉદ્ઘેખિત રકમ અને તેના પર વ્યાજ ત્રણ લેનારનું ધ્યાન સુરક્ષિત અસ્કયામતો રિડીમ કરવા માટે ઉપલબ્ધ સમયના સંદર્ભમાં કાયદાની કલમ ૧૩ ની પેટા-કલમ (૮) ની જોગવાઈઓ તરફ આમંત્રિત

કરવામાં આવે છે. તારીખઃ ઓક્ટોબર ૧૯, ૨૦૨૨ અધિકૃત અધિકારી જેએમ ફાઇનાન્શિયલ હોમ લોન લિમિટેડ માટે .ચળઃ વડોદરા

વર્ષ ૨૦૨૫ સુધીમાં સંરક્ષણ ઉત્પાદનને ૨૨ બિલિયન ડોલર સુધી વધારવાનું લક્ષ્ય : રક્ષામંત્રી રાજનાથસિંહ

(પ્રતિનિધિ)અમદાવાદ,તા.૨૦ ગાંધીનગરમાં ખાતે રક્ષામંત્રી શ્રી રાજનાથ સિંહે ૧૨મી ડિફેન્સ એક્સપો-૨૦૨૨ ના ભાગ રૂપે આયોજિત ઈન્વેસ્ટ ફોર ડિફેન્સ -રોકાણકાર આઉટરીચ ઈવેન્ટ દરમિયાન ભારપૂર્વક જણાવ્યું હતું કે, ૨૦૨૫ સુધીમાં ભારતમાં સંરક્ષણ ઉત્પાદન ૧૨ બિલિયન ડોલરથી વધારીને ૨૨ બિલિયન ડોલર કરવાનો લક્ષ્યાંક છે. જે આગામી વર્ષોમાં સંરક્ષણ ઉદ્યોગને વૃદ્ધિ માટે અપ્રતિમ તકો પૂરી પાડશે. તેમણે ભારતીય સંરક્ષણ ક્ષેત્રમાં સ્થાનિક ઉદ્યોગ અને વિદેશી ઇક્વિપમેન્ટ ઓરિજિનલ મેન્યુફેક્ચરર્સને ભારતીય સંરક્ષણ ક્ષેત્રનો ભાગ બનવા અને વૈશ્વિક પુરવઠા શૃંખલાઓને એકીકૃત કરવાની તકનો લાભ લેવા આમંત્રિત કર્યા હતા. ભારતીય સંરક્ષણ ઉદ્યોગ માટે આ એક

સુવર્ણ સમય છે. ભારતીય સંરક્ષણ ઉદ્યોગની સિદ્ધિઓ પર પ્રકાશ પાડતા રક્ષામંત્રીએ કહ્યું કે, સ્થાનિક ઉદ્યોગોએ ફાઇટર એરક્રાફ્ટ, એરક્રાફ્ટ કેરિયર, મેઇન બેટલ ટેન્ક અને એટેક હેલિકોપ્ટર બનાવીને તેની ક્ષમતાઓ દર્શાવી છે અને આ પ્રોજેક્ટ્સ દ્વારા ઇકોસિસ્ટમ બનાવવાનો અનુભવ મેળવ્યો છે. આ અનુભવ ભવિષ્યની પેઢીઓ માટે સંરક્ષણ શસ્ત્રો/સિસ્ટમોને ટેકો આપવા અને વિકસાવવામાં મદદ કરશે. તેમણે ડિફેન્સ એક્સપો-૨૦૨૨ને વર્તમાન અને સંભવિત રોકાણકારો માટે ભારતીય સંરક્ષણ ઉદ્યોગની અસાધારણ વૃદ્ધિનો એક ભાગ બનવા માટે એક ઉત્તમ પ્લેટફોર્મ ગણાવ્યું હતું.

તેમણે જણાવ્યું હતું કે, સંરક્ષણ ક્ષેત્રમાં ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટના ધોરણોને ઓટોમેટિક રૂટ દ્વારા ૭૪ % અને સરકારી રૂટ દ્વારા ૧૦૦% સુધી ઉદાર કરવામાં આવ્યા છે અને શેરબજારોમાં વેપાર પારદર્શક બન્યો છે. જેનાથી સંરક્ષણ કંપનીઓને પણ ફાયદો થયો છે.

સંરક્ષણ ક્ષેત્રમાં ખાનગી રોકાણકરોને પ્રોત્સાહિત કરવા માટે સરકારે સંરક્ષણ બજેટનો ચોથો ભાગ ઉદ્યોગની આગેવાની હેઠળનાને સમર્પિત કર્યો છે. સંરક્ષણ ક્ષેત્રમાં સ્થાનિક ઉદ્યોગની ભાગીદારી વધારવા માટે. સરકારે વર્ષ ૨૦૨૨-૨૩ માટે સ્થાનિક ખરીદી માટે સંરક્ષણ મૂડી સંપાદનના ૬૮% અનામત રાખ્યા છે, જે અંદાજે રૂ. ૮૫.૦૦૦ કરોડ છે અને આમાંથી ૨૫% સ્થાનિક પ્રાઇવેટ ઉદ્યોગ માટે આરક્ષિત કરવામાં આવ્યા છે. આ તમામ પગલાંએ છેલ્લાં કેટલાંક વર્ષોમાં સંરક્ષણ નિકાસની વૃદ્ધિમાં પરિણામ આપ્યું છે.

પ્રેમ પ્રકરણમાં બ્લેકમેઇલિંગ

વડોદરાના વેપારીએ વિધર્મી પરિણીતા સાથે प्रेम इर्थो अने जहलामां तेने मोत मण्य

વડોદરા,તા.૨૦ વડોદરા શહેરના જુની આરટીઓ ઓફિસ પાસે રહેતા મયુર નાનજીભાઇ પટેલને ફતેપુરા મારવાડીના ડેલામાં રહેતા દરવેશ સલીમ મલેકની પત્ની સલમા સાથે પ્રેમસંબંધ હતો. આ વાતની જાણ પતિ દરવેશને થતાં તેને મયુરને બ્લેકમેલ કરવાનું શરૂ કર્યું હતું અને આશરે સાડા ચાર લાખ રૂપિયા પડાવ્યા હતાં. આટલેથી ન અટકતા દરવેશ હજી પણ વધુ રકમની માંગણી કરતો અને મયુરને કોઈને કોઈ રીતે માનસિક ત્રાસ આપતો. જેથી જ તેના ત્રાસથી કંટાળી જઇ યુવા વેપારી મયુરે ઝેરી દવા પી આત્મહત્યા કરી લીધી હતી.

આશાસ્પદ યુવા વેપારી મયુરે ચાનક આપઘાત કરી લેતા આખો પરિવાર આઘાતમાં સરી પડ્યો હતો.પરિવાર ના સભ્યો દ્વારા મૃત્યુ અંગે તપાસ કરતા મયુર હની ટ્રેપ નો શિકાર થયો હોવાનું સામે આવ્યું હતું જેથી મયુર પટેલનાં પિતાએ સમગ્ર મામલાની જાણ દ્વારા છેલ્લા ત્રણ વર્ષથી મયુર પટેલને બદનામ કરવાની ધમકીઓ આપી માનસિક ત્રાસ આપવામાં આવતો હતો અને અત્યાર સુધી પત્ની સાથે આડા સબંધના નામે ધમકી આપી ૪.૫૦ લાખ જેટલી ૨કમ પડાવી લેવામાં આવી હતી. જેથી પોલીસે દરવેશ મલેકની ધરપકડ કરી તેની પાસેથી રોકડ સહિત ઘાતક હથિયાર કબ્જે કર્યું છે. વેપારીને આપઘાત માટે મજબૂર કરનાર દરવેશને હાલ જેલ હવાલે કરી દેવામાં આવ્યો છે. તો સાથે જ પોલીસ દ્વારા મૃતક મયુર પટેલ સાથે પ્રેમ સબંધ રાખનાર દરવેશની પત્ની સલમા મલેકની પૂછપરછ હાથ ધરવામાં આવી છે.

કાશ્મીર ખીણમાં ૬૦૦ થી વધ હાઇબ્રીડ આતંકવાદી સક્રિય

શ્રીનગર, તા.૨૦ કાશ્મીર ખીણમાં પ્રવાસી મજરો અને કાશ્મીરી પંડિતોના ટાર્ગેટ કિલિંગને લઈને મોટો ખુલાસો થયો છે. કાશ્મીર ખીણમાં સક્રિય હાઈબ્રિડ આતંકવાદીઓ અને વિદેશી આતંકવાદીઓ વચ્ચેનું કનેક્શન સામે આવ્યું છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે કાશ્મીર ખીણમાં હાલમાં ૬૦૦થી પણ વધુ હાઈબ્રિડ આતંકવાદીઓ સક્રિય છે. વિદેશી આતંકવાદીઓ આ હાઈબ્રિડ આતંકવાદીઓની મદદ કરી રહ્યા છે. તેમનો ઉદ્દેશ્ય પરપ્રાંતિય મજૂરો અને પંડિતોને ટાર્ગેટ કરીને ખીણમાં દહેશત ફેલાવી રહ્યા છે. સુરક્ષા દળો અને કાશ્મીર પોલીસ સતત આતંકવાદીઓની યોજનાને નિષ્ફળ બનાવવાનો પ્રયાસ કરી રહી છે. હાઈબ્રિડ આતંકવાદીઓની આ ભૂમિકા છેલ્લા ૧૦ મહિનામાં

श्वाननी भदृहथी पड़डाई रोणडी : पाहननी शेभ रेनना सेन्श्रिनमांथी थती हती डीऊसनी योरी

વાહનોમાંથી પેટ્રોલ અને ડીઝલ ચોરી થવા વિશે તો તમે સાંભળ્ય જ હશે, પરંતુ કચ્છના સુરબારી રેલવે સ્ટેશન પર માલગાડીના એન્જિનમાંથી ડીઝલ ચોરી કરનારા ચાર લોકોની ધરપકડ કરવામાં આવી છે. પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળના રેલવે સુરક્ષા બળને જાણકારી મળી હતી કે કચ્છના આ સ્ટેશન પર આ પ્રકારની ગતિવિધી થાય છે. શ્વાનની મદદ લઈને પોલીસે ૨૯ હજારથી વધારે કિંમતના મુદ્દામાલ સાથે ચાર લોકોને પકડી પાડચા હતા. ઘટનાની વિગતવાર વાત કરવામાં આવે તો સુરબારી સ્ટેશન પર રાતના સાડા દસ વાગ્યે માલવાહક ટ્રેન ઉભી રહેતી હતી, જેમાંથી ડીઝલ ચોરી થતું હોવાની જાણકારી મળી હતી. સેલ્ફ ઈન્સપેક્ટર, RPF, માલિયા મિયાણાનો સ્ટાફ આ જાણકારી મળ્યા

જ્યારે લોકો પાયલટ અને તૈનાત ગાર્ડ સાથે મળીને તપાસ કરવામાં આવી તો જાણવા મળ્યું કે, માલગાડીની ફ્યુલ ટેક્રનું ઢાંકશુ ક્ષતિગ્રસ્ત છે. ટ્રેનના ડ્રાઈવરે જણાવ્યું કે, ટાંકીમાંથી પાઈપની મદદથી ડીઝલ કાઢવામાં આવ્યુ હતું અને તેમને લગભગ ૨૦૦ લીટર ડીઝલ ભરેલા બે ડ્રમ પણ મળી આવ્યા હતા. ડ્રાઈવરે અંધારુ હોવાને કારણે ટોર્ચ મારી તો જોયું કે અમુક લોકો ભાગી રહ્યા હતા. સ્થળ પર જરૂરી કાર્યવાહી કર્યા પછી ૪૨૦ લીટર ચોરીના ડીઝર ભરેલા ૨ ડ્રમ જપ્ત કરવામાં આવ્યા હતા અને ત્યારપછી ચોરને પકડવાની કાર્યવાહી તાત્કાલિક ધોરણે શરુ કરવામાં આવી હતી. RPF કંટ્રોલ રુમ અમદાવાદ અને કાઈમ બ્રાન્ચના ઈન્સ્પેક્ટર સાથે સંકલન કર્યા પછી ટ્રેકર ડોગને બોલાવવામાં આવ્યા હતા. આ

શ્વાનોએ ચોરીમાં ઉપયોગમાં લેવામાં આવેલા સાધનોને સૂંઘ્યા હતા અને ત્યાર પછી તેના આધારે શોધતા શોધતા સુરબારીના એક ઘર નજીક જઈને અટકી ગયા હતા. આસપાસના લોકો તેમજ અન્ય બાતમીદારોની મદદથી પૃષ્ટિ કરવામાં આવી હતી કે શ્વાને જે ઘર પર શોધ પૂરી કરી તે પરિણામ સાચુ હતું. ઘરની અંદર પણ ડીઝલની વાસ આવતી હતી. તેમની જયારે પૂછપરછ કરવામાં આવી તે સ્વીકાર્યું કે ચાર શખ્સોએ ભેગા મળીને માલગાડીના એન્જિનમાંથી ડીઝલની ચોરી કરી હતી. આ ચોર જયારે ઘટનાને અંજામ આપી રહ્યા હતા ત્યારે એક કર્મચારી આવી જતા ૨ ડ્રમ ડીઝલ, પ્લાસ્ટિકની પાઈપ, લોખંડનો સળિયો, હથોડી વગેરે છોડીને ભાગી ગયા હતા. પરંતુ ૩૦ લીટર ડીઝલ ભરેલ એક ડબ્બો તેઓ સાથે લઈ જવામાં સફળ રહ્યા હતા.

INEOS STYROLUTION

Driving Success. Together.

INEOS STYROLUTION INDIA LIMITED

CIN: L25200GJ1973PLC002436

Read, Office: 5th Floor, OHM House - II, OHM Business Park, Subhanpura, Vadodara - 390 023. Tel. No.: +91 265 2303201 / 2303202

Poor		cshare@ineos.com Website: www.ineosstyrolutionindia.com pmmittee of Independent Directors (IDC) of INEOS Styrolution India Limite	
("Tar Limi ("PA in th Targ Acq	rget Company") on the O ted ("Acquirer") togethe C 2") and Mr. Rahul Agra eir capacity as the pers et Company, under Reg	pen Offer (hereinafter defined) made by Shiva Performance Materials Private I with Geetganga Investment Private Limited ("PAC 1"), Mr. Rakesh Agraw. wal ("PAC 3") (PAC 1, PAC 2 and PAC 3 collectively to be referred as "PACs" cons acting in concert with the Acquirer, to the public shareholders of the julation 26(7) of the Securities and Exchange Board of India (Substantia akeovers) Regulations, 2011 and subsequent amendments thereto ("SEE	
1.	Date	October 20, 2022	
2.	Name of the	INEOS Styrolution India Limited	
	Target Company (TC)		
3.	Details of the Offer pertaining to TC	Open offer for acquisition of up to 45,72,263 fully paid-up equity shares of face value INR 10 each ("Equity Shares") from the Public Shareholders of the Target Compan representing 26.00% of the Voting Share Capital of the Target Company on a ful diluted basis as on the 10th working day from the closure of tendering period, at a prior of INR 848.72 per Equity Share (the "Offer Price") aggregating to total consideration up to INR 388,05,71,054 (assuming full acceptance) payable in cash. The public announcement dated August 1, 2022 ("PA"), the detailed publistatement published on August 5, 2022 ("DPS"), the draft letter of offer date August 10, 2022 ("DLOF"), and the letter of offer dated October 17, 2022 ("LOF") have been issued by JM Financial Limited on behalf of the Acquirer and the PACs.	
4.	Name(s) of the acquirer	Acquirer: Shiva Performance Materials Private Limited	
7.	and PAC	PACs: Geetganga Investment Private Limited (PAC 1) Mr. Rakesh Agrawal (PAC 2); and Mr. Rahul Agrawal (PAC 3).	
5.	Name of the Manager to the offer	JM Financial Limited 7th Floor, Cnergy, Appasaheb Marathe Marg, Prabhadevi, Mumbai - 400 025. Tel:+912266303030 Fax:+912266303330 Contact person: Ms. Prachee Dhuri Email: ineos.openoffer@jmfl.com	
_		SEBI registration no.: INM000010361	
6.	Members of the Committee of Independent Directors (Please indicate the chairperson of the Committee separately)	Mr. Vinesh Sadekar (Chairperson) Ms. Sandra Martyres (Member)	
7.	IDC Member's relationship with the TC (Director, Equity shares owned, any other contract/relationship), if any	The members of the IDC are independent directors on the board of directors the Target Company. None of the members of the IDC hold any Equity Share securities of the Target Company. Except as mentioned below, none of the members of the IDC have entered into any contract or have any relationship withe Target Company: a. Mr. Vinesh Sadekar is the chairperson of the Audit Committee, the Nominationand Remuneration Committee and Risk Management Committee of the Target Company, and is a member of the Corporate Social Responsibility Committee the Target Company; and b. Ms. Sandra Martyres is the chairperson of the Stakeholders Relationship as Grievance Committee and the Corporate Social Responsibility Committee of the Target Company, and is a member of the Audit Committee and the Nomination Remuneration Committee of the Target Company.	
8.	Trading in the Equity shares / other securities of the TC by IDC Members	None of the members of the IDC have traded in any of the Equity Shares securities of the Target Company during the: a. 12 months period preceding the date of the PA; and b. period from the date of the PA and till the date of this recommendation.	
9.	IDC Member's	None of the members of IDC:	
5.	relationship with the acquirer (Director, Equity shares owned, any other contract / relationship), if any.	a. are directors on the boards of the Acquirer or the PACs; b. hold any equity shares or other securities of the Acquirer or the PACs; and c. have any contracts/ relationship with the Acquirer or the PACs.	
10.	Trading in the Equity shares / other securities of the acquirer by IDC Members	None of the members of the IDC have traded in any of the equity shares/ securities the Acquirer or the PACs during the: a. 12 months period preceding the date of the PA; and b. period from the date of the PA and till the date of this recommendation.	
11.	Recommendation on the Open offer, as to whether the offer is fair and reasonable	The IDC is of the opinion that the Offer Price of Rs. 848.72 (Indian Rupees Eigh hundred forty-eight and paise seventy two only) per Equity Share offered by the Acquirer is (a) in accordance with the applicable regulations under the SEBI (SAST Regulations, and (b) accordingly, the Open Offer appears to be fair and reasonable. However, IDC would like to point out that the share price of the company in dynamic in nature and is subject to daily fluctuations and change. The closing share price (as at the end of day October 19, 2022) of the Target Company on the NSE was INR 839.40. The shareholders are advised to independently evaluate the open offer and take a	
12.	Summary of reasons for recommendation	informed decision, whether or not to tender their equity shares in the open offer. The IDC has reviewed the PA, the DPS, and the LOF. Further, Shailesh Haribhakti& Associates, Chartered Accountants, appointed by the IDC to provide its independent opinion, has confirmed that the Offer Price of 848.72 (Indian Rupees Eight hundred forty-eight and paise seventy two only) provided is in accordance with the Regulation 8(2) of the SEBI (SAS) Regulations and opined that the Offer Price of 848.72 (Indian Rupees Eight hundres forty eight and paise seventy two only) per Equity Share is fair and reasonable. In view of the above, the IDC has set out its recommendation in paragraph 11 above. This statement of recommendation will also be available on the website of the Targ Company at	

provide its independent opinion with respect to the Offer Price To the best of our knowledge and belief, after making proper enquiry, the information contained in or accompanying this statement is, in all material respects, true and correct and not misleading, whether by omission of any information of

https://www.ineosstyrolutionindia.com/INTERSHOP/web/WFS/Styrolution-India-

Site/en_US/-/USD/ViewContent-Start?PageletEntryPointID=investors-investor

Shailesh Haribhakti & Associates, Chartered Accountants, appointed by the IDC to

The recommendation was unanimously approved by the members of the IDC

otherwise, and includes all the information required to be disclosed by the Target Company under the SEBI (SAST) For and on behalf of the Committee of the Independent Directors

of INEOS Styrolution India Limited Vinesh Sadekar

Chairperson - Committee of Independent Directors

DIN: 00046815

Details of voting pattern

Details of Independent

Advisors, if any.

highlighted

Place: Mumba

Date: October 20, 2022

15. Any other matter(s) to be